

૩.

૪૮

૧૨૦
જન શ્વેતાંખર તેરાપંથી ધર્મનો દુંડો

ધિતિહાસ

છપાવી પ્રસિદ્ધ કરનાર

વકીલ છોગમલળ ચોપડા

સેકેટરી જૈન શ્વેતાંખર તેરાપંથી સભા

૧૫૬ કોસ સ્ટ્રીટ સુતાપટી ત્રીજે માળે કલકત્તા.

મુદ્રક

નટવર એમ. વીમાવાળા

“ગાંધીજી” સુરધ્યાલય, હવાડિયો, ચકલો, સુરત.

૨૨

1367

શુદ્ધપત્રક.

સંગ્રહ

પાઠ	લિટી	આશુદ્ધ	શુદ્ધ
૩	૫	દોકોતર	દોકોતર
૩	૮	ઇન્દ્રિય	ઇન્દ્રિય
૩	૯	દોકોનાર	દોકોતર
૩	૧૪	દ્રેષ	દ્રેષ
૩	૧૪	પર-મોહ	પરમોહ
૩	૧૪	દ્રેષ	દ્રેષ
૩	૧૫	રાગ „	રાગ „
૩	૧૬	દ્રેષ	દ્રેષ
૪	૨	ઓાર	અથવા
૫	૮	દોકો	દોકોને
૬	૪	દોષી છું	દોષીત છું
૬	૭	કીચીત	કીચીત
૬	૧૦	દોષી છું	દોષીત છું

પાઠ	લીટી	અશુદ્ધ	શુદ્ધ
૬	૧૮	એકનિંદ્ય	એકન્દ્ર્ય
૬	૧૮	પંચનિંદ્ય	પંચન્દ્ર્ય
૭	૧૫	કાગદ	કાગળ
૮	૧	ચતુવિધ	ચર્તુવિધ
૮	૧૬	છરીની	છરીથી
૯	૪	છચ્છાથી	છચ્છાની
૯	૧૫	કરાતે	કરાવે
૧૦	૮	જીવનો	જીવને
૧૦	૨૦	મારી	મારા
૧૩	૨૨	પિયત્તમા	પ્રિયત્તમા
૧૪	૧	આપધાત	આપધાત
૧૪	૧૮	સુદર	સુંદર
૧૭	૧૫	પાત્પ	પ્રાપ્ત
૧૭	૨૩	ઉદ્દેશ્ય	ઉદ્દેશા
૧૮	૮	પ્રકટ	પ્રગટ
૧૯	૧૮	દ્વંદ્વ	દ્વંદ્ર
૨૦	૩	મીશુ	મીહું
૨૦	૪	અતુક્પાહાન	અતુક્પા
		આહાનથી	દાનથી નાના

પાઠ	લીટી	અશુદ્ધ	શુદ્ધ
૨૦	૬	વઢે છે	વધે છે
૨૧	૨	ચાદિત્ર	ચારિત્ર
૨૧	૧૧	ચિત્ર	ચિત્ત
૨૧	૧૫	ચિત્ર	ચિત્ત
૧૧	૧૬	અશુદ્ધ	અશુદ્ધ
૨૧	૨૦	ત્રણુ કારણુ	ત્રણુકરણુ
૨૧	૨૧	હુરાએક	હુરેક
૨૨	૭	અવાદાનથી	અવા દાનથી
૨૨	૧૦	પરિગઠ	પરિશઠ
૨૨	૧૭	ળિડા	ળિંડા
૨૩	૧૨	સાર્ગ	માર્ગ
૨૪	૧	પ્રકૃતિ	પ્રકૃતિ
૨૪	૧૮	સ્વામીથી	સ્વામીશ્રી
૨૪	૨૩	ધર્મની	ધર્મનો
૨૪	૨૩	ચારે	ચારે
૨૫	૧૦	સાધુ	સાધુએ
૨૬	૧	મહુતકાંક્ષાને	મહુત્વકાંક્ષાએ
૨૬	૩	એકાતરા	એકાંતરા
૨૬	૫	યોવનાવસ્થામાં	યોવનાવસ્થામાં હુતા

પાનુ	લીટી	અશુદ્ધ	શુદ્ધ
૨૭	૫	એકાંતએકાંત	એકાંત
૨૭	૬	આ હેશો	આહેશો
૨૭	૧૪	પડીલેહુણુપડી	પડીલેહુણુ
૨૭	૨૦	મંથણ	મંથન
૨૮	૨	વાળી હુતી	વાળો હુતો
૨૮	૪	અસુયાયી	અનુયાયી
૨૮	૨૩	ઢાવાઈ	ઘોવાઈ
૨૮	છેલ્લી	અવસ્થ	અવસ્થ્ય
૩૦	૩	હો	હોય
૩૦	૪	આત્મા	આત્મ
૩૦	૬	રૂધનાથજીની	રૂધનાથજીના
૩૦	૬	ભરેલી	ભરેલો
૩૦	૧૭	ઝુઠી	ઝુઠો
૩૦	૨૧	સાચા	સાચો
૩૧	૧	વીનતીનો	વિનતીની
૩૧	૪	થયા	પામ્યા
૩૧	૫	કરાવાવાના	કરવાના
૩૧	૧૦	પાલવા	પાળવા
૩૧	૧૨	પાલવા	પાળવા

પાઠ	લીટી	અશુદ્ધ	શુદ્ધ
૩૧	૨	ભીખણુણ	ભીખણુણાં
૩૨	૩	આધાકમી	આધાકમી
૩૨	૮	જમવા	જમવા
૩૨	૧૩	રઘનાણ	રઘનાથણ
૩૨	૧૩	નેમલળની	નેમલળના
૩૪	૧	કહ્યા હે	કહ્યું છે
૩૪	૫	સ્વામીણ	સ્વામીણ
૩૪	૭	પરિષિહુા	પરિષિહુ
૩૫	૧૨	હુરાવ્યો	હુટાવ્યો
૩૫	૩	વૃચોવૃદ્ધ	વૃચોવૃદ્ધ
૩૫	૧૫	અતલાવ્યા	અતલાવી
૩૫	૧૬	કર્યા	કર્યો
૩૬	૨	સીરીયા	સીરીયારી
૩૬	૮	સીરીયા	સીરીયારી
૪૧	૧	આ આજામાં	આજામાં
૪૫	૮	પુળ	પુલ
૪૫	૧૨	સાચ્યા	સાચા
૪૬	૨૦	મારી	મારા
૪૭	૧૦	મૃષવાદ	મૃષાવાદ

પાઠ	લિટી	આશ્રૂદ્ધ	શુદ્ધ
૪૮	૧૦	માત્રને	માત્રનો
૪૯	૧૪	ખેત્ર	ક્ષેત્ર
૪૯	૧૫	ધન્ય	ધન
૪૯	૧૫	પાંગા	પગા
૪૯	૧૮	પેરા	પેટા
૪૯	૨૦	સુર્યાદય	સુર્યોદય
૫૪	૨	જીવ	જીન
૫૪	૨	જાણુ	જન
૫૪	૨૨	લોકો ન	લોકોને ન
૫૫	૪	લક્ષણુમાં	લક્ષણુમં
૫૮	૧૩	ચાહે છે છે	ચાહે છે
૫૯	૧	નિવિકાર	નિવિકાર
૬૧	૫	ધર્મ	ધર્મ
૬૧	૮	ધન્ય	ધન
૬૨	૭	દ્વારા નીરક્ષા	દ્વારાની રક્ષા
૬૩	૨	અકારણીય	અકરણીય
૬૩	૧૧	વર્તિતા	વર્તિતા



પ્રસ્તાવના

સંસારમાં ધર્મ સંખેદી જુદી જુદી વ્યક્તિઓએ
જુદા જુદા અર્થ કીધા છે પરંતુ આધુનિક જેટલા મુખ્ય
મુખ્ય ધર્મ મત પ્રચલિત છે તેને અહીંસા ને સારા
ખતલાવ્યા છે જૈન ધર્મ અહીંસા લત્વ ને જેટલી મહુ-
ત્વા આપે છે. તેટલી બીજા કોઈ ધર્મ અહિંસાને આપતા
નથી જૈન ધર્મમાં અહીંસાની વીશીષતા માટે અને
પાળવા માટે વિશેષ ધ્યાન અને આલોચના કરી છે જૈન
સંપ્રદાયના મુખ્ય એ વિલાગ શ્વેતાંખર ને દીગંખર છે
તેમાં શ્વેતાંખરમાં મુર્તિપુજક સ્થાનકવાસી અને તેરાપંથી
એમ ત્રણુ શાખા છે એ ત્રણુ શાખા આગમ યાને સુત્રને
પ્રમાણ માને છે પરંતુ કોઈ ૮૪ આગમ ' કોઈ ૪૫
આગમ કોઈ ભત્રીશ આગમ અને તેથી મલતી વાતો
માને છે જૈનેતર આગમ પ્રમાણના અધડામાં પડતા નથી

ન્યાય ને શુકૃતી સંગત વાત માનવા તૈયાર છે તેથી કૈન શ્વેતાંખર તેરાપંથી સંપ્રદાયના મુખ્ય તત્ત્વ કેના પર ખીજ લોક ઉડો વિચાર કરે નહી તે નાના પ્રકારની કટાક્ષ કરે છે માટે સરવ ભાષામાં તેના ઉપર પ્રકાશ કરવો ઉચ્ચીત ધારે છે.

સંસારી જીવ અનાદી કાળથી કર્મવશ જન્મ મરણુને પ્રાપ્ત કરતા પરિખિમણ કરી રહ્યા છે કર્માના સર્વથા નાશ થવાથી જીવ સુકૃત થાય છે કર્મથી જીવ બંધાઈ રહ્યો છે બંધનથી છુટકારો એ મોક્ષ છે કર્માના ઝળ લોગવવા પડે છે શુલ કર્મ કરવાથી શુલ ઝળ ને અશુલ કર્મ કરવાથી અશુલ ઝળ પામે છે જગતમાં સાધારણ માલમ પડે છે કે જે કામ કરીએ તેનું તેવું ઝળ મળે છે કોઈ કામનું ઝળ તે વખતે માલમ પડે છે કોઈ કામનું ઝળ પછી હેખાય છે પ્રકૃતિના આ નિયમ નીઝળ જતો નથી.

સમસ્ત કર્મથી છુટકારો મેળવવો એ જીવનો સ્વ. સ્વલ્લાવમાં નિજગુણુમાં વર્તવું છે જીવ સ્વલ્લાવથી વીશુદ્ધ, ઉન્જવળ, જ્ઞાનમય, ચૈતન્યમય છે કૈનેતર મતોમાં જો આત્માને પરમાત્માનો અંશ બતલાવે છે તે વાસ્તવમાં અંશ તો નહી પરંતુ આ અર્થથી સત્ય છે કે પરમાત્મા પરમેશ્વર અથવા મોક્ષ પ્રાપ્ત જીવ પોતાના સમસ્ત ખાદ્ય કર્મવરણુથી મુકૃત છે હુરએક જીવ જ્યારે સમસ્ત ખાદ્ય આવરણથી હુર થઈ સ્વ. સ્વરૂપમાં ખીરાને છે ત્યારે પરમાત્મા થદ્ધ બાય છે. કોઈ પણ પ્રકારના બંધન આવરણ ન રહેવાથી તે જીવ

કે કરી સંસારમાં આવતો નથી તે નિર્વિકાર અણસ્થામાં આત્મિક સુખમાં તહ્વાન રહે છે તે સુખ નિસ્વાચ્છિન્ન, નિસાબાધ છે બધા જીવ સુખને માટે ચહુાય છે. લોકીક વૈષયિક સુખમાં શાંતિ નહી આશા ઈચ્છા અને આકાંક્ષાઓ પુર્ણ કરવામાં જીવને સાચા સુખ લોકોન્તર સુખ મંલતું નથી.

સંસારી જીવ નાના મોટા સર્વ કલ્પનિક લોકીક સુખ પાઠળ મંડી રહ્યા છે અને વૈષયિક અથવા ઈન્હિય ગૃહિતના સુખને લોકોન્તર સુખ માની રાખ્યા છે જીવ ગૃહણ્યા, લોલ, મોહ, રાગાદિક ને વશ સામાન્ય ક્ષણીક લોકીક સુખને સુખ માની કે છે પરંતુ વાસ્તવમાં તેહ હુઃખનું કારણ છે અને સાચુ લોકોન્તર સુખ તેનાથી મંલતું નથી જુઓ “જૈન” ધર્મની ચોપડી જ્યાંસુધી રાગ-દ્રેષ્પ પ્રથમ્ય સ્વજન પસ મોહ, પરજન ઉપર દ્રેષ્પ છે ત્યાં સુધી છુટકારે સંસારથી થતો નથી રાગદ્રેષ્પ સમસ્ત કર્માના ખીજ શ્રી જૈનેશ્વરે કર્માંયો છે પરંતુ દ્રેષ્પ જેણ્ણે જલદી ઓળખાય છે તેણેં રાગ જલદી ઓળખાતો નથી ભમત્વ, મોહ, સ્નેહ, રાગ વીજેરે તેના બરોઅરીયા છે પોતાના શરીરથી ભમત્વ રાખવો મુક્તીના બાધક છે શરીરથી ઘ્યારું આ સંસારમાં ખીનુ કોઈ નથી ત્યારે ખીન કોઈથી ભમત્વ લાવ, રાગ લાવ સ્નેહલાન, મોહલાવ મુક્તીના લોકોન્તર માર્ગના બાધક જરૂર થશે જૈનધર્મમાં પરમ પુરુષ વીતરાગ છે તેરાપંથી મત વીજદ્ધ કેટલાક લોકો એવી જુડી વાત ફેલાવે છે કે એ મત દ્વારાન રહીત

છે શુક્રમ દ્રષ્ટિથી જે લોક કોઈ ધર્મ કે મતની સમીક્ષા કરે છે તે ગમે તે કહે પરંતુ ગહુન એઓ સત્ય વીચારથી જોવાથી એ આશેપ તથન ખોટો છે એમ માલમઠશે સંસારના તમામ કામ હિતાહિતની નજરથી વીચારથી છે સમાજમાં રહેવાથી નાના પ્રકારના બંધન ફરેક મનુષ્યને સહુન કરવા પડે છે વ્યક્તિગત સ્વાતંત્ર અને સ્વભંગતા ને બધાના હૃતને માટે સંકુચિત કરવા પડે છે સંસારિક અને સામાજિક હૃતને માટે નાના પ્રકારના વૈષયિક કામ કરવા પડે છે સંસાર, રાષ્ટ્ર, દેશ અથવા સમાજની વૃદ્ધિ, ઉન્નતિ અથવા અર્થલાલ વીજેરે કામને માટે નાના પ્રકારની હિંસાના કામ કરવા પડે છે. ચુદ્ધ, વિશ્રણ, વ્યાપાર, વણુજ વીજેરે કામમાં નૈતિક અથવા પરમાર્થિક ઉન્નતિનો લેશ માત્ર નહી આત્મીય સ્વજન ઉપર મમત્વ લાવ, સ્વજન પોણણુ, દેશ કે રાષ્ટ્ર માટે મમત્વ લાવથી ખીજા રાજ્ય કે ખીજ દેશવાલાને જોડે નાના પ્રકારના સામ, દામ, દંડ લેદાદી ઉપાયથી કાર્ય કરવા પડે છે પરંતુ તે સર્વ કામથી જીવનું કલ્યાણ થતું નથી એ બધા કામ સંસારી, ગૃહસ્થ, લોકીક ઉન્નતિ માટે સમાજની અંદર રહેવાથી કરે છે આત્મીક કલ્યાણ, લોકોત્તર કલ્યાણ તો મન, વચન, કાયાથી ત્રણ કરણુને ત્રણ જોગથી કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવું નહી, ખીજથી પહોંચાડાવવું નહી અને દુઃખ દેતા હોય તેની અનુમોદના કરવી નહી તેથી થાય છે અને એજ છકાયની દ્વારા પાગવાનો ઉપાય છે શ્રી તીર્થંકરદેવે, શ્રી ગણુધર

મહુરાજે, શ્રી આચાર્યને, શ્રી ઉપાધ્યાય લગવાને અને શ્રી સાધુભૂતે એજ હ્યા પાણી છે કોઈ પણ જીવને કષ્ટ આપવાથી આત્મા કલુભિત થાય છે પ્રાય સર્વે આર્થ ધર્મ હિંસાને દુખોત બતાવે છે પરંતુ આ સિદ્ધાન્ત સમ્યક્તવ પાળવાવાળા વીરલા મળે છે એટલું જ નહી પરંતુ અહિંસા તત્ત્વ જે હ્યા ધર્મનો પર્યાયાન્તર છે તે સદગુર વિના સમજવો કઠણુ છે.

જીવ હુસા ખોટી માનવાવાળા ધણુા લોકો જીવ અજીવની એળખાણુ હેતી નથી એકેન્દ્રીયથી પંચેન્દ્રીય સુધી દરેક જીવને હુઃખ દેવું હુસા છે પરંતુ કોઈ લોક એકેન્દ્રીય જીવને મારી પંચેન્દ્રીય જીવના પોષણમાં દોષ નહી કહે છે તે ન્યાય સંગત નથી થીર ચીતથી વીચારવું જોઈએ કોઈ લોક શ્રી વીતરાગે ફરમાવેલી હ્યાના રહુસ્ય જાણુતા નથી અસંયતીનુ જીવનુ વાંછવામાં એટલે મોહુરાગમાં ધર્મ સમજે છે આ જગ્યાએ એક ઉડો પ્રક્રિ ઉત્પન્ન થાય છે કે જીવ ખચાવવા (કોઈની સામર્થ્ય નથી) અને જીવ ન મારવામાં શું ફેર છે બહુસ્ની નજરથી એક બીજથી ફેર લાગતો નથી પણ ધણો ફેર છે સંસારમાં અનંતા જીવ સ્વકર્મ વશ મરે છે.

ન્યાં સુધી કોઈ જીવ પોતે ખીલને ન મારે ન મરાવે મારતાને લદો ન જણો ત્યાં સુધી ખીલ જીવો મરે તેનો દોષ તેને માથે આવતો નથી કોઈ જીવ ખીલ જીવને મારી રહ્યો છે તેને ખચાવવાનો પ્રયાસ ન કરે તો શું ગુંઢો થાય છે હુમારા ઉપર શું હુક છે મારી આપ્તમ

બિન્નતીમાં આ નિરપેક્ષ લાવ સુખાધક થાય છે જ્યાં સુધીં
 હું પોતે મારતો નથી ખીજ પાસે મરાવતો નથી અને
 મારે તેને સારો સમજતો નથી ત્યાં સુધી હું કેવી રીતે
 હોષી છું જેવાથી કે સાંભળવાથી દોષ લાગતો નથી જો
 લાગે તો કેવળીને બધો દોષ લાગવો જેઠ્યે જો કદાચ
 મારી સામે ખીજ જીવ ને મારતો હોય તો મન વચન
 કાયાએ કરી કીચીત પણ તે કાર્યમાં ઉત્તેજીત કરે નહીં
 સારો જાણે નહીં જો હું ખીજે કે ત્રીજે કરણે કરાવવું કે
 અનુમોદિત કરે તો હોષી છું પણ મરવાવાળાની હુંસામાં
 દોષ સમજે અથવા તે હુંસાથી નીવૃત્ત થવા ઉપદેશ
 દેવામાં સર્કળ ન થાય અથવા ઉપદેશ દેવાનો અવસર ન
 હોય તો મરવાવાલા જીવનો કર્માદ્ય સમજી તટસ્થ લાવ
 ધારે તો મારા કામમાં ન્યાયની દ્રષ્ટિથી કોઈ પણ દોષ
 લાગે નહીં તર્ક માટે એ માની લીધું જય કે પ્રત્યેક
 જીવનું કર્તાબ્ય છે બળવાન બળથી હુર્ભણનો બળપ્રેરોગ
 કરી રક્ષા કરવી ઉચીત છે તો વીચારવાની વાત છે કે
 આ સિદ્ધાન્ત શું એકનિદ્યથી લગાવી પંચનિદ્ય સુધી
 ફરેક જીવ ધાત માટે અને ફરેક સમયે લાગુ થશે અથવા
 એક જીવ ખીજ જીવને ખાવાનું સમજી મારે છે તેજ
 જગ્યાએ લાગુ થશે અથવા એક જીવ ખીજ જીવને
 કૌતુહલ રમત વશ મારે તેમાં લાગુ થાય જીવ દ્વારાના
 નામથી કર્તાબ્યના માપની હુદ રાખો ઉપરોક્ત હુંસામય
 કામમાંથી કયું રોકવું જેઠ્યે સંસારમાં ખીજ મારકૃત જો
 હુંસાત્મક કાર્ય થાય છે તેમાં પોતાના સ્વાર્થની હાની કરી

ને હુંસાથી રનેહું વશ રક્ષાના ભાવ પેહા થાય તેજ રેણું રેણું સારી છે. કે બીજુ હિંસા આંખ બંધ કરી ઉપેક્ષા કરી જવું કર્તવ્ય છે.

એક જીવથી મરતો બીજે પ્રાણી બચાવી લેવો Thestreticay કહેવા સારુ માલમ પડે છે પણ (Practically) આ સીદ્ધાંત સર્વત્ર પાલવા ચોગ છે? છેલ્લી સીમા સુધી Extreme limits સુધી લઈ જવાથી મશકરી જેવું લાગશે બીજથી મરતા જીવની રક્ષા કરવી તે તેના પર પ્રેમ, રનેહું, મોહુ મમત્વ, રાગ લાવથી થાય છે ત્યારે જ્યાં મોહુમમત્વ રનેહું છે ત્યાં જીવને બંધન છે અને જ્યાં મારવાવાલાની અંતરીક કલુષતા ઉપરેશ દઈ હુંસાથી હુર કરવાને તેને હુંસાના ઝુરા પરીણું સમજવી હુંસાથી નીવૃત કરવા એ સાચું કર્તવ્ય છે.

તેરાપંથી મતનો સિદ્ધાંતના રહસ્ય ન સમજું ધણું લોકો બીજની નીદા કરવા તથા લોળાલાઈયોને બહેકાવવા માટે ગંભીર દાર્શનિક તત્વોને ઉલટાવી અનર્થક કાગદ શાહી અને સમયનો હુરઉપયોગ કરે છે જેવી જેની પ્રતી થાય છે તે રહેજમાં છુટતી નથી પણ કોઈ મત સમજન્યા વગર અથવા સમજવાનો પ્રયત્ન કર્યા સૌવાય પ્રતિષ્ઠિત લખનાર કલમ ચલાવે છે તે ધણું ઓહું માલમ પડે. છે.

જ્યારે આ દ્રષ્ટાંત હેવામાં આવે છે કે કોઈ હુષ્ટ વ્યક્તિ કોઈ અનાથ બાળકના પેટમાં છરી લોકી હે તો તે બાળકને બચાવી લેવામાં તેરાપંથી પાપ સમજે છે તેના પર વિવેચન કૈન જનતા ચાર વિભાગોમાં વહેચાય લી છે સાખું, સાધવી શ્રાવક, શ્રાવીકાચા ચારેના સમુદ્ધાયને

ચતુવિધ સંધ કહે છે ચારે મુક્તિના ઈચ્છુક છે અને તેને
માટે પ્રયત્ન કરે છે સાધુ સાધી પંચ મહાવતના પચ-
ખાણુ ધારી હોય છે એટલે તેમને મન, વચન, કાયાથી
કરવુ, કરાવવું અને કરે તેને અનુમોદવું આ ત્રણુ કરણુ
સર્વથા અહીંસા અસત્ય, અસ્તેય, અહુમર્યાર્ય અને અપ-
રીથુ એ પાંચ મહાવત એટલે કેાઈ પ્રકારે પાપ યાને
સાવધ કાર્ય કરતા નથી કરાવતા નથી ને અનુમોદન
કરતા નથી.

શ્રાવક, શ્રાવિકા અહુસ્થી હોવાથી ત્રણુ ત્રણુ
ચોગથી મહાવત પાળી શકતા નથી તેથી તે અનુવતોને
પોતપોતાના સામર્થ અનુસાર પાળે છે સર્વથા સાવધ
પરિહિત તેનાથી થધ શકતા નથી જે દ્રષ્ટાંત છોકરાના
પેટમાં ચાપુ લોકવાનો અપાય છે તેના ઉપર એટલુંજ
કહેવું પુરતુ છે કે જુનાજા પ્રમાણે ચાલવાવાળા જૈન
સાધુ સાધી એવા અવસરે મજાકુર અનાથ બચ્ચાને દુષ્ટ
ઘાતકની છરીની. બચાવી શકતા નથી તેઓ તો એવા
અવસરે જે શાંભવ હોય તો ઉપહેશ દ્વારા ઘાતક ને દુષ્કૃતથી
નિવૃત્ત કરે અન્યથા આ જેવું અસહુનીય હોય તો
તે જગ્યા છોડો બીજી જગ્યા ચાલી જાય ઉપહેશથી હીંસ-
કને સમજાવી દુષ્કૃત્યથી નિવૃત્ત કરવો વીતરાગ પડ્યોપીત
ધર્મ છે પણ બળ પ્રયોગ, લાલચથી શરમાશરમથી ખાંઝે
લાંઝે, ગ્રાંઝેથી બચાવવામાં શ્રી જૈનેશ્વરનો ધર્મ નથી માટે
બળપ્રયોગથી કેાઈને કુષ્ટ પહોંચાડી બચાવી લેવો એ
જૈનેશ્વર કુથીત ધર્મ નથી જે એવી અવસ્થામાં નિર્દ્યતાનુ-

કલંક બતાવે તો સાધુ સાધી જે આ ભાગકને નથી અચાવતા તે પાપ કરે છે સાધુ સાધીને પુછવાથી કહે કે હુમેં સંસારથી ત્યાગી છૈયે હુમારે સંસારીક રક્ષણુંની કૃચ્છાથી મતલખ નથી પણ તેઓએ તો સાવધના ત્યાગ કીધા છે જે એ કામ સાવધ નથી તો પોતે કેમ કરતાં ત્યારે જિતરમણે કે ગૃહસ્થના કોઈપણ કાર્ય કરવા સાધુ સાધી ને મના છે હુવે વીચારો જે કાર્ય સાધુ સાધીની કરે નહીં તે કામ ગૃહસ્થી ન કરે તો શું ઘટયું વાસ્તવમાં ગૃહસ્થ સંસારી મનુષ્ય સ્નેહ, મમતા, મોહુ ને વશ એવા સ્થળમાં બળ પ્રકાશથી બીજાના હુથથી નીરપરાધ જીવને અચાવવા કોશિશ કરે છે.

તો એમાં ઘાતકના આંતરિક લાંબોમાં ફેરફાર થયો નહીં તેની કલુષિત ચિત્ત વત્તીને સારા વીચારમાં ફેરવી ઘાતકને આરંભ ડિંસાથો નિવૃત્ત કરાતે તો તેના આત્માનું કલ્યાણ થતે ભાગક બચે કે મરે તે ભાગકના સ્વકર્મ પ્રેરણું છે તેના અચાવ મરવાથી લાભાદાલના ઝ્યાલથી નહીં પરંતુ ઘાતકની મનોવતી સારે માર્ગે લાવવાનો પ્રયાસ છે તે સ્તુત્ય છે જૈન સિધાન્તોમાં અદાર પ્રકારના પાપ બતલાય્યા છે તે પ્રાણુત્તિપાત, મૃષાવાદ, અદત્તા દાન, મૈથુન, પરિચહુ, કોધ, માન, માયા, લોલ, રાગ, દવેષ, કલહ, અસ્યાખ્યાન, પૈશુન્ય, પર પરીવાદ, રતિ અરતિ, માયામૃષાવાદ, મિથ્યા હર્ષન શલ્ય છે તેમાં રાગ (સ્નેહ મમત) એક પાપ છે કોઈ જીવ, પર મમત્વ લાવથી અચા-

વવાનો પ્રયત્ન આત્માના રાગ (અનુરાગ, મોહુ, સ્નેહ) ભાવ છે એ સર્વથા છોડવા જોગ છે સંસારો જીવ માટે સંસારીક પ્રેમ બંધન છુટવા અસ્વલાવિક છે પરંતુ નીષ્પામ ભાવથીનીર્વિરાધ ચિત્તથી પોતાની પ્રીય વસ્તુનું અનિષ્ટ જોઈ કોઈ પ્રકાર માનસિક ચંચળતા ન આવવાના ભાવને જો સર્વ લોક ઉંડાં વીચાર ન કરે, દાર્શનિક તત્વોને ન સમજે, વીકૃત ધારણું કરે છે તે મોટી લુલ થાય છે.”

“એક જીવનો ત્રાસ આપો ખીજ જીવની રક્ષા કરવી રાગહવેષ છે રાગહવેષ એકાંત પાપ છે એ તો આડમા, નવમા, દશમા ગુણુસ્થાન જીવો પર લાગુ થાય છે ત્યાં અંતરંગ ધર્મ બહુ ઉંચી કોઠીના છે ખાદ્ય ધર્મ પાલન કરવામાં પોતાના આત્માની કલુષતા અથવા પોતાના આત્માના હુઃખ હુર કરવા ખીજ જીવની સહાયતા લેવી પડે છે જેમ કોઈ જનવરનું હોરડું જેનાથી તે ખાંધેલું છે તે ખળવાન ખીજે જનવરના પંખમાં પડી જાય ને તે જખરજસ્તી તે પાણી તરફ એંચી રહ્યો છે અને તે હોરડીથી બંધાયલા જનવરની તકલીફ જોઈ હુઃખ ઉત્પન્ન થાય કે જરા પણ સહુન કરીશ નહી તો મારી આત્માનું હુઃખ હુર કરવા (નહી કે તે જનવરનું હુઃખ હુર કરવા) જો તે હોરડું કાપી નાંખી તે જનવર છોડાવીને ગયા તો એવા ખળપ્રયોગ કરવામાં પાપ નહી કેમકે એને તો પોતાની કલુષતા હુર કુધી છે પોતાને માટે ખળપ્રયોગ કર્યો છે જનવર માટે નહી” આવો તર્ક મારા એક મિત્રે કરી ઉપરોક્ત દ્વારાંત આપ્યું બંધાયેલા જીવને છોડાવવાના કારણું પોતાના

આત્માની કલુષતા હુર કરવાની બતલાવી એવી રીતે એવાં
મીતે એ પ્રકાશન્તરથી મારા સિદ્ધાંતનું સમર્થન કર્યું
હુઃખી જીવનો ઉદેશ સામે નહીં રાખી પોતાની આત્માનો
કલેશ હુર કરવા માટે કોઈ હુઃખી જીવને બગાવે તો તે
જગ્યાએ તેનું કામ આત્મિક કલ્યાણકારક થાય તે વીચાર-
વાની વાત છે ખીલ હુઃખી જીવને જોઈ અહુસ્થ માત્રના
હૃદયમાં સ્વતઃ એક પ્રકારની સહાનુભૂતિ, સમવેહનાના
લાવ પ્રકટ થાય છે એ લાવ ઉપર કથનાનુસાર આઠમા,
નવમા, દશમા ગુણુસ્થાન વર્તી જીવના ઉંચા પ્રકારના
અંતરંગ ધર્મ નથી સાધુ મુનિરાજ અથવા ઉંચા ગુણુસ્થાન
વૃત્તિ મહુત્મા ગણુ એ સંસારીક સમસ્ત મોહુ મમત્વ
છોડી દીધા છે. તે સંસારીક હુઃખી જીવ જોઈ મોહુમાન
થાય નહીં.

એ તો સર્વ સુખ હુઃખ સ્વસ્વ શુભાશુલ કર્મના
ક્રીણ સમજી જ્યોને કર્મ ક્રીણના દૃષ્ટાંત બતલાવી સાવચેત
કરે છે પરંતુ બંધન છોડાવવા આત્મિક કલ્યાણનું કારણ
હુતે તો આઠમા, નવમા, દશમા ગુણુસ્થાનવાલાની વાત
હુર રહી પણુ છઠ્ઠા, સાતમા ગુણુસ્થાનવાળા સાધુ મુનિરાજ
પણુ છોડાવતા નથી ને તેના અનુયાયી જવાખ પણુ આપી
શકતા નથી છઠ્ઠાથી ઉપરના ગુણુસ્થાનવાલા મહાપુરુષોનો
એકજ સિદ્ધાંત છે માટે કોઈ પણુ આવી જગ્યાએ બળ
પ્રયોગથી જીવ બંચાવવામાં ધર્મ સમજતા નથી વળી એ
પણ વીચારણું જોઈએ કે ખીલ જીવને હુઃખી જોઈ હુમારા
મનમાં હુઃખ ઉત્પન્ન થયું તે રાગ, સ્નેહ, મમત્વ, મોહુ

ભાવ છે જીવનુ જીવવુ વં છે તે રાગ મરવુ વં છે તે દ્વેષ
 અને સંસાર સમુદ્રથી તરવું વં છે તે કલ્યાણુનો લોકોત્તર
 માર્ગ છે બાધ્ય બંધનથી છોડવવાથી હુઃખી જીવનુ હુઃખ
 હુર થતુ નથી તે જીવની કર્મ વર્ગના હુટાવો સંવર
 નિર્જરાના માર્ગ અતલાવી લવિષ્યમાં જીવને કર્મ બંધનથી
 કલેશ ન થાય તેવો ઉપાય કરવાથી હુઃખનુ કારણુ રોકાય
 છે અને એજ શ્રી લગવાનનો ઉપહેશ છે રાગ ભાવથી
 સંસારી જીવનો વધ, બંધ, તાડના ભય, શોકાદિ હુઃખ
 જોઈ કોઈ મતુષ્યના હૃદયમાં જો તીવ્ર હુઃખ થાય તે
 મોહ અનુકર્પા છે તેથી આત્મા કલુષિત થાય છે પણ
 એ કલુષિતા હુર ત્યારેજ થાય કે હુઃખના કારણભુત
 કર્મોના સ્વરૂપ સમજ તે કર્મોનો નાશ કરવા પ્રયત્ન
 કરાય કોઈ બંધાયલા જીવના બળવાન કૃત ઉપદ્રવ જોઈ
 બંધાયલા જીવનુ બંધન કાપી નાંખે તો પોતાની આત્માની
 કલુષતા હુર કરવાનો ઉપાય નથી આત્માની એવી કલુષતા
 હુર કરવા અનિત્ય અશરણાદિ બાર ભાવના વીજેરેનો
 વિચાર કરે કે અહોકર્મોની શું વિચિત્ર ગતિ છે આ
 હુઃખી જીવે કેવા કર્મો ઉપાર્ગન કર્યા છે.

કે તે કર્મો આ રીતે સત્તાવે છે અને તેથી એ
 શિક્ષા લેવી જોઈએ કે કોઈને પીડા ન હેવી કેમકે તેના
 ઝળ લોગવવા પડે છે એવી ભાવનાઓથી લોકોત્તર કલ્યાણ
 થાય સંસારમાં ચારે ખાળુ નજર કરીએ તો બળવાન
 હર્ભલ પર ચાહે તે કારણુથી અથવા ગમે તે નામથી
 અત્યાચાર ગુણરે છે પોતાના તરફથી કોઈની હુઃખ ન

પહોચાડવું હુઃખ ન પહોચાડવવું અને હુઃખ પહોચાડતાં
ને સારુ ન સમજવું ત્યાંસુખી એ હુઃખ જોડે કોઈ તાલુક
નથી હુમે તેના ભાગીદાર નથી જે હુઃખ દેશો તે તેનું ફળ
લોગવશે જેવાવાલા સાંલલવાવાલાની કોઈ જોખમહારી નથી
જે જેવાથી ને સાંલલવાથી પાપ લાગે તો કેવલી અને
. સીખ લગવાનને બધું પાપ લાગવું જોઈએ બીજું દૃષ્ટાંત.

૧ કોઈ ચોર બીજાનું ધન ચોરે છે કોઈ ચોરને
કહી ચોરી કરાવે છે કોઈ તે ચોરને અનુમોદન કરે છે
એ ત્રણે અદ્દતાદાન (ચોર્ય) કે પ્રતના ખંડન કરવા-
વાલા છે.

૨ કોઈ વશળુવની હિંસા કરે છે કોઈ હિંસા કરાવે
છે કોઈ હિંસાની અનુમોદના કરે છે એ ત્રણે અહિંસા
પ્રતના ખંડન કરવાવાલા છે.

૩ કોઈ મૈથુન (કુરીલ)માં રત છે કોઈ કહીને
મૈથુન કરાવે છે કોઈ મૈથુન સેવવાવાલાની અનુમોદના કરે
છે આ ત્રણે પ્રદ્યાર્ય પ્રતના ખંડન કરવાવાલા છે.

હું કોઈ મહાત્મા ત્રણે પ્રકારના અદ્દતાદાનના
અહિંસા પ્રતના, અને પ્રદ્યાર્યના ખંડન કરવાવાલાએને
નાના પ્રકારની યુક્તિ તર્ક ઉપદેશાદ્યથી તેના કુકૃત્યથી
નિર્વિત કરી હે અને તેવી નિવૃત્તિથી ચોરી છોડવાથી
ગૃહસ્થનું ધન ગયું નહીં હિંસા છોડવાથી જીવ
વધ થયો નહીં અને મૈથુન ત્યાગવાથી તે પિયતમા
કામિની વિરહાતુર થઈ આત્મહૃત્યા કરે તો ધનરક્ષા,

જીવરક્ષાથી જે ધર્મ થાય તો સ્વીના આપધાતતું
 તે મહુતમાને અધર્મ લાગે એડને ચોર હુસિકને સમજન-
 વવાથી ખીજા ધણીના ધનરક્ષા ને જીવરક્ષા થઈ પ્રહૃદયર્થ
 સંગ કરવાવાલાને સમજવવાથી તેઓએ જવ જીવ
 પ્રહૃદયર્થ પાળવાનો નીયમ લીધા તેમ કરવાથી તેની સ્વી
 આત્મહૃત્યા કરી જે પહેલા એ ટેકાણે ધનરક્ષાને જીવરક્ષા
 સમજવામાં આવે તો સ્વીની આત્મહૃત્યાના અધર્મ
 ઉપદેશદાતા જરૂર ન્યાયની દૃષ્ટિથી થશે પરંતુ વાસ્તવમાં
 ધનરક્ષા અને જીવરક્ષા અથવા સ્વીનો આપધાત આ ગ્રણે
 જોડે મહુતમાને કોઈ સંબંધ નથી તેઓનો ઉપદેશ ચોર,
 હુસિક અને મૈથુન લોગીકુશીલીયા ને ગર્હિત કૃત્યોથી
 ભયાવવાનો છે તે કાર્ય તેઓએ કર્યું તે કાર્યથી ખીજને
 લાલ અથવા મોત થયું તેને માટે જવાણદાર નહી ઉપદેશ
 આપી કૃકૃત્યોથી ભયાવવાના પ્રત્યક્ષ અને તાત્કાલીક
 (Direct and immediate result) ઇલ છે તેઓના
 આત્માને પાપ કાર્યથી નીવૃત્ત કરી ઉન્નત કરવા અને
 ખીજની આત્મા ઉન્નત કરવાથી સાધુને પોતાના મુક્તિ
 સાધનાના ધર્મનું પાલન કીધું તેની પરોક્ષ એટલે સુદરવૃત્તી
 (Indirect and remote result) ઇલ સ્વરૂપ જે ધનરક્ષા,
 જીવરક્ષા અને સ્વી હૃત્યા થઈ તેને માટે મહુતમા ન્યાય
 કે તર્કથી કુળલાગી નથી અને તેના તે કર્તા નથી કેમકે
 તેઓએ ચોર, હુસિક, કુશિલીયાને તારવા ઉપદેશ આપ્યો
 છે ધનરક્ષા, જીવરક્ષા, સ્વીહૃત્યા માટે ઉપદેશ નથી આ
 સિદ્ધાંત તેરાપંથી સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ પુજનીય

શ્રી બીજુસ્વામીજીએ નાના દેહરામાં સમજાવ્યો છે. જીવ જીવ તે હ્યા નહીં, મરે તે તો હિંસા મતિ બાન મારખુવાલાને હિંસા કહી, નહીં આરે હો તે તો હ્યા અણુભાવ

અર્થાત અનંતા જીવ સંસારમાં જીવી રહ્યા છે તેની હ્યા નહીં અનંતા જીવ સંસારમાં મરે છે તેની હિંસા નહીં મારખુવાલાને હિંસા લાગે, નહીં આરે તેને હ્યા પાળી બહુર દૃષ્ટિમાં આ સિદ્ધાંત વોકીકમતથી જુદા હોવાથી નવો માલમ પડે છે પરંતુ ખારીક વિચાર કરવાથી સ્વકર્મ પ્રમાણે મરતા જીવતા રહે છે ત્રણે કરણું ત્રણું યોગથો પોતાની આત્માથી કોઈ જીવ ન મારવો ન મરાવવો ન લડો જાણુવો એ પોતાની આત્માની ઉજ્જ્વલીના ઉત્કૃષ્ટ સાધન અને ખીજને પાપથી છોડાવવા ઉપદેશ આપી હિંસાથી નિવૃત કરવા તે પણ આત્મિક વિકાશ છે અન્યથા ઝડકત જીવ રક્ષા નિમિત બળપ્રયોગ કરી ખીજને હિંસાહથી નિવૃત કરવાથી તેમાં શું લાલ થયો તે જુવો જેને હિંસાથી જખરીથી નિવૃત કિધો તેની મનોવૃત્તિમાં ઝરક થયો નહીં. (૩૦. change of heart) જ્યાં સુધી મનોવૃત્તીમાં ઝરક નહિ ત્યાં સુધી તેને હિંસાને હિંસા સમજી ત્યાગ નહી કીધા કાલસૌરીક કસાઈ માઝક બળવાનના બળપ્રયોગથી તે એક વખત હિંસાથી નિવૃત થયો પણ માનસિક ઝરકાર (change of heart) ન થવાથી તેની આત્મ ઉજ્જ્વલી થઈ નહી જે જીવની રક્ષા થઈ તેની રક્ષાની દૃષ્ટિથી વિચાર થાય તો માલમ પડે કે બચનાસ્ની આત્માનું શું કલ્યાણ થયું! તે જીવ એક હુસિકથી બચ્યું પરંતુ ખીજ હિંસકથી

અથવા ગેરન્યી નહી મલી ને તે હિંસક જીવ ઉપર દ્વેષ લાવ રાખશો રક્ષક તરફ ભમત્વ રાખશો તો રાગદૈધના. કંડવા ફળ લોગવવા પડશો આત્મિક ઉજ્ઞતિ માટે રક્ષિત જીવને કોઈ પણ સાધન રક્ષકથી મલયું નથી. જે તે જીવ એકાંત સ્વભાવથી (perfect equanimity) હિંસક જીવ પ્રત્યે કષાય રહીત થઈ અકર્મ ફ્રલના કારણું હુમારી એહ હિંસા કરી રહ્યા છે મારા આત્મિક ગુણું છે તેનો એ નાશ કરી શકતો નથી હેઠને પ્રાણુથી જુદા કરે તો મને પ્રવ્યાહ નથી.

હુ સ્વકર્મ ફળ સમજ હિંસકની હિંસાની ઉપેક્ષા કરીશ પણ આ હિંસક મારીં હિંસા કરતા કેટલા પાપ ઉપાર્જન કરે છે હું એને એના નિજકૃત પાપથી નિર્વત કરી શકતો નથી એવી રીતે આ લોચના ચિંતવન કરવાથી પોતાના કર્મ બંધન શિથિલકર બીજને કર્મબંધનથી અચાવવા પોતાની અસામર્થ્યનો વીચાર કરે તો શુદ્ધ ઉત્તમ ધ્યાનથી આત્મ વીકાશ કરી શકે છે રસ્તે ચાલતા જીવના હૃદયમાં Third party mere spectator તે હિંસક ને જેઠને હુણુનારું પ્રતિ પર હુઃખ કાતરતાકાં રાગ લાવ અથવા હિંસક ઉપર દ્વેષ લાવ હોય તો આત્મ ચિંતવન દ્વારા સંસારીક રાગ દ્વેષોને અનર્થના મુળ સમજ ઉક્ત ડાર્યોની નીંદના, ગરુના કરવાથી પોતાના હૃદયની કલુષતા હુર કરી શકે છે સંસારમાં જીવ માત્ર નાના પ્રકારના સ્વઉપાર્જુત હુઃખ અથવા કષ્ટ લોગવી રહ્યા છે. તેનાથી કોઈ પણ શાનીનો હુદય મલીન થવો ન જેઠયે

અજ્ઞાનીની વાત જુદી છે હૃદયના કાલુષ્ય મળીનતા તો પોતાના કોઈ કુકૂર્યને માટે અથવા પોતાના રાગલાવ, મોહુ, મમતા, સ્નોહ, પ્રેમ બંધનથી થાય છે રાગ, મોહુ, સ્નોહ, પ્રેમ એ સર્વ સંસારના બંધન છે સંસાર સુક્રિતનો બાધક છે અધ્યાત્મિક ઉન્નતિમાં અંતરાય ભુત છે જ્યારે પોતાના આત્માને માટે સર્વેના ક્ષેય લક્ષ્ય એમ છે કે સંસાર પરિખ્રમણું મીટાવી સુક્રિતમાં જવું સંસારિક સમસ્ત બંધનોથી છુટકારો પામવો ત્યારે ખીંચ જીવની રક્ષાને માટે લોલ કરવો તે મોહુ અથવા સ્નોહવશ થાય છે સાંસારીક જીવન ધારણું કરવા કોઈનું ચરમ લક્ષ નથી તેમ કેદુંને જીવાડવાને અસંયમ જીવીતબ્ય વંછવામાં મોક્ષ માર્ગ સાધકને ફૂયદો નહીં.

સમર્પ્ત કર્મોથી અલગ થવું બધા કર્મો પર વિજ્ય મેળવવો એજ ધર્મનું લક્ષણું છે અથવા આત્મિક સુખ પાત્પ કરવામાંજ કૈન લોક પોતાનું કર્તાબ્ય સમજે છે. સંસારમાં સર્વ જીવ અખંડ સુખ ચાહે છે પરંતુ તેના યથાર્થ સાધન અથવા માર્ગ જ્ઞાનતા નથી ધન્દ્રિય જનિત સુખમાં લીન થઈ પોતાની આત્માને કર્મોથી લારી કરી સુખ ને બદલે હુઃખ મેળવે છે મનુષ્ય જન્મ પામી કર્મ રહૂત થઈ આત્મિક સ્વભાવમાં રહેવું અર્થોત સુક્રિત જવું ક્લોકોત્તર માર્ગ લેવો એજ કૈન ધર્મનો સાર છે. સંસારમાં રહેવું કૈન ધર્મનો સાર નથી સંસારથી સુક્રત થવું જીવને શાસ્વત સુખમાં તલ્વીન કરવો કૈન ધર્મનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ આ લેખની આશાએ, પસ્લોકની આશાએ, જીવનની

આશાયે, મરણુની આશાયે, લોગ વિવાસની આશાયે કરવો
તેજ મમત્વ છે જૈન ધર્મનો સાચો સમજનાર સંસારિક
સુખને વંછતો નથી સાચા સુખને પ્રાપ્ત કરવાના સાધનથી
જરૂર સંસારિક સુખ પણ ઉત્પન્ન થાય છે શાસ્ત્રીય
શ્રદ્ધામાં કહેવાય છે કે નિર્જરા નીકરણીથી પુણ્ય પોતાની
મેળે લાગે છે જેમકે ઐડુત ઘઉં માટે એતી કરે સાથે
ધાશ છોડા પોતાની મેળે થાય છે માટે દરેક માણુસનું
કામ છે કે પોતાના નિજ ગુણું પ્રકટ કરવાનો ઉદેશ રાખે
જૈન ધર્મનો સાચ્યો ઉપાશક જન્માંતરમાં વૈષયિક સુખની
પ્રાપ્તિ થાય એમ માનતો નથી ક્ષણીક સુખ મેળવી જીવતો
રહું એવી કલ્પના કરતો નથી સંસારિક હુઃખો સહુન
ન થવાથી અસમર્થ થઈ મૃત્યુ ચહાતો નથી નાના પ્રકા-
રના લોગ વિવાશ સુખની આશા કરતો નથી જૈન ધર્મનો
ઉપાશક મરવું, જીવું, સુખ હુઃખમાં સમભાવ રહી જન્મ
મરણુને હુર કરી શાસ્ત્રત આત્મિક સુખને માટે ચહાય છે આ
સિદ્ધાંતની પુણી ખીજ ધર્મોમાંથી પણ મદ્દે છે જેમ ગીતામાં
કહ્યું છે કે “સુખ હુઃખ સમ કૃત્વા લાલાલાલો જ્યા જ્યો.”

આવો ડર્ય ધ્યેય જેનો હોય છે તે ખીજના મરણથી
મોહુ પામતો નથી ખીજના શારીરિક વધ અંધ તાડનાદિકના
કુઠથી વિચલિત થઈ ક્ષણીક હુઃખથી મુક્ત કરવાને
માટે ખીજને હુથે અચાવવાને લીધે ઉધમ કરવો એ
એ મુખ્ય સમજતા નથી હુઃખ કણોના છુટકારાતો કર્મ-
અંધનથી મુક્ત થવાથી થશો તે જૈની માત્ર જને છે
પોતાના કર્મ અંધન કાપવા માટે તેનો ઉધમ થાય છે

તેમજ ખીજના કર્મ કાપવા માટે ઉત્સાહહિત કરવા તેને
માટે તેને જાન, દર્શન, ચારિત્રના સાહાય આપવી કર્ત-
વ્ય સમજે છે ખીજ સંસારિક રક્ષણુ, સંસારિક કૃત્ય
રાગદેવેષ સહીત છે કોઈની સ્નેહવશ ખીજના હુમલાથી
રક્ષા કરવી તે પોતાના કે તેના જાન, દર્શન યા ચારિત્ર
ગુણુની વૃદ્ધિના સહાયક નથી જરા સ્થીર ચિત્તથી વીચારો
કે નિષ્કામ જૈન ધર્મ નિર્મભત્વ, નિર્માહુસ્ત, વીતરાગ-
ત્વથી દરેક આદમીને ઉત્સાહહિત કરે છે સંસારિક સમસ્ત,
હુઃખ, કષ્ટોને પોતાના કર્માદ્યથી આવેલા માને છે વીરની
માર્ગક સામનો કરી લોગવવા માટે જૈન ધર્મ લોકોને
કહે છે હર તરેહની આવેલી આઝીત
જૈન ધર્મ ખીદકુલ અવિચલિત ચિત્તથી સામના કરવા
કહે છે તે ધર્મમાં જીવ રક્ષાનો ખીજે અર્થ થવો સંલઘ
નથી પોતાથી કોઈ જીવને કષ્ટ ન પહોંચે પુર્વ કર્મ
ક્રાંતિક ખીજથી ન પહોંચાડાવે કોઈ કષ્ટને હુર કરવા
મળુષ્ય તો શું પણ દેવતાની તાકાદ નથી ભગવાન
મહૂાવીર ને જેટલા દેવતા મળુષ્ય કૃત ઉપસર્ગ થયા
તેમાં અનુક્રમ્યા અથવા દયા કરીને કોઈ દેવતા, ઈન્દ્ર
હુર કરી શક્યા નહી વળી તે લોક નિશચેષ કેમ રહ્યા
શું તે લોક દયા નહી સમજતા હતા

દયાના વિષયમાં ઉપર કલું હુવેદાનના વિષયમાં કહું
કું પ્રાય એમ કહેવાય છે કે તેરાપંથી જૈન પાંચ મહા-
પ્રતધારી સાધુને છોડી ખીજાઓને દાન આપવામાં પાપ
અતિલાવે છે દાન શર્ષણના ધર્ષણા અર્થ છે શ્રી સ્થાનાંગ

દર્શા પ્રકારના દાન શ્રી જૈનેશ્વરે બતાવ્યા છે.

૧. રોગાર્ત, શોકાર્ત, કુપણું દીન, માણુસને ગાજર, ભુજા વીગેરે કંદમુળ, અનંત વનસ્પતિ કાચિકળું મીથુ, પૃથ્વી કાય, એકેન્દ્રિય જીવ, અભિન, પાણી વીગેરે અનુકંપાદાન (આદાનથી નાના પ્રકારના એકેન્દ્રિય જીવેને આપી અચોષ્ય પાત્ર ને હિંસા, ઝુઠ, ચોરી, મૈથુન, પરિયહુમાં રક્ત છે તેનું પોષણું કરવાથી જીવની ઉન્નતિનું શાધન નથી પાત્ર. સુપાત્ર નહી ચીજ દેવા લાયક સુજતી નહી તે દાનથી સંસાર વઢે છે.

૨. કેદીઓને પૈસા આપી છોડાવવા તેનું નામ્ન સંઅહુદાન છે તે જીવની ઉન્નતિ લાયક નથી.

૩. અહુ, શાંતિને માટે અથવા ખીલુ શાંતિ સ્વસ્તયનને માટે ધરના અથવા ખીલ ખાલખણું ને દાન આપે છે તે ભયદાન છે તે સંસારીક કષ્ટથી કરી આપવાનું છે પરલોકનું કલ્યાણું નહી.

૪. મરે તેની પાછળ ત્રીયો, બાર્ષિ, તેરસુ કરેં લોજન કરે તે કાલુણી દાન કહેવાય છે તેથી આત્માને લાલ નહી લોકીક પ્રથા છે.

૫. વાર્ષિક, છ માસી, શ્રાદ્ધમાં લોક લજનથી ને અપાય તે લજન દાન છે સંસારિક પ્રથા છે.

૬. લઘમાં વરકન્યાને વેવાઈને પહેરામણી, મોસાળ વીજેરે દાન દેવાય છે તે ગર્વ દાનથી સંસારીક વહેવાર છે.

૭. નટ, નટી, મહલાદિને ખુશ થઈ કુપાત્ર ગણીકાને.

આપાથ તે અર્થર્મ દાન છે સંસારની મોટાઈ છે.

૮. ધર્મશિક્ષાતુ દાન, સમ્યક્તલ ચાહિતનુ દાન, અલય દાન છ પ્રકારના જીવને ન મારવા તે ધર્મદાન છે તે વોકેાતર માર્ગ છે જીવ તેથી મોક્ષ જાય છે.

૯. સચિત્ર દ્રવ્યાહિક પાણી લેવા માટે આપવા તે કાયંતિ દાન છે આત્માની ગરજ સરે નહીં.

૧૦. પરસ્પર સામાજિક પ્રથાનુસાર દ્રવ્યાખ્યાન, મોજાખ્યાન, ચાંલ્બો તે કંતતી દાન છે તેથી જીવ કર્મથી મુકાય નહીં.

આ બધામાં આડમું ધર્મદાન જેમાં જીનદાન, અલયદાન, સુપાત્રદાન મળે છે તેજ સાચુ દાન છે તેમાં ચિત્ર, વીતા, પાત્ર ત્રણે શુદ્ધ છે તેજ ઉત્કૃષ્ટ દાન છે શુદ્ધ મનથી શુદ્ધ સુજતી વસ્તુ સુપાત્રને આપે તેજ ઉત્કૃષ્ટ દાન છે બીજી શુદ્ધ મનથી કુપાત્રને શુદ્ધ વસ્તુ આપી અથવા શુદ્ધ હૃદયથી અશુદ્ધ ચીજ કુપાત્રને આપી ઈત્યાદિ ચિત્ર, વિત્ત, પ્રાત્ર ત્રણેમાંથી એક પણ અશુદ્ધ છે તે દાન અશુદ્ધ છે તે પર લોકના કલ્યાણ હેતુ નથી કારણું કે તે દાનનું પ્રકષ ક્રણ મળતું નથી સુપાત્ર તેજ છે કે જે હિંસા કરે નહિં, જુદુ બોકે નહીં, ચોરી કરે નહીં, મૈથુન સેવે નહીં, પરિશ્રહ રાખે નહીં ત્રણ કારણું ત્રણ જોગથી તેજ સુપાત્ર છે હરએકને દાન આપવામાં સંસારિક ઉપકાર છે પરંતુ ઉખર શેત્રમાં બી વાવવાથી નીર્થેક જથે હિંસક, જુડા, ચોર કુશીલીયા અને પરીશ્રહ ધારી ને જે આપતુ છે તે અસંયમમાં સહ્ય છે તેમાં વોકેાતર સુક્ષ્મણી આશ્ચ

રાખી શકાય નહીં, દીન હુઃખી જે દેખાય છે તે પોતાનાં
 કર્મ વશ હુઃખ પામે છે તેને સહાય કરી ધર્મમાં દ્રદ
 કરી સમચિતથી હુઃખ કણ્ઠ સહુન કરવા ઉપહેશ કરવો
 એજ તેના હુઃખને ફૂર કરવા રૂપ સાચો ઉપકાર છે રૂપીયા
 પૈસા અન્ન, પાણી વીગેરે ક્ષાળીક ઈન્ડ્રિય સુખ આપવાથી
 તે વખતે દીન હુઃખીની આત્માને ઉન્નત કરતા નથી એ
 વાદાનથી સાધારણું સંસારિક ઉપકાર અથવા કીર્તી સીવાય
 ખીંલે લાલ નહીં વીવેક બુધ્ધિથી આ સર્વ દાનની ચોંયતા
 વીચારવાથી માલમ પડશો કે અચોંય પાત્રને સચિત્તાદિ
 આપી અથવા રૂપીયા પૈસા, પરિગઠ અપાવી તેની ક્ષાળીક
 તૃપ્તિથી તેને કર્મ બંધનના રસ્તા ખોલી પરદોકીક બંધ-
 નમાં બંધ કર્યા છે એવા દાનથી સંસારમાં પણ લાલ નથી
 એક માત્ર ધર્મના રસ્તામાં સુમાર્ગમાં લાવવાથી ઉત્કૃષ્ટ
 દાન છે ખીંલ દાન નામ માત્ર છે ન્યાયની કસોટીમાં આ
 પ્રશ્નને રાખી આત્મિક ઉજ્ઞતિ જ્ઞાન, દર્શન ચારીત્રની
 બૃધ્ધિથી વીચારવું સામાજિક કે વિષયિક લાભાલાભથી આ
 વાત વિચારવી નહીં તેરાપંથી સ્વિદ્ધાંતોના ઊડા તંત્વો
 દેખડાવ્યા છે જે ભાઈને તેરાપંથી મત સીદ્ધાંતો દેખડાવ્યા
 છે તે ભાઈ વિશેષ માહીતી મેળવવા ચાહુતા હોય તેઓએ
 તેરાપંથી મુનીરાને શાં. ૧૯૬૭ના વૈશાખ મહિનામાં સાણું દ
 ધાંયદ્રા તરફ વીચરે છે તેઓથી જણે ખીંલની કલ્પિત
 જુઠી વાતો પર ધ્યાનનું આપે પોતે સંતસંગ કરે જણે શ્રી
 ૧૦૦૮ શ્રી તુલસીસુરીજીનું શાં. ૧૯૬૭ ગુજરાતી સાલનું
 ચામાસુ રાજલહેશર (ખીકાનેર) છે તેઓને પૂછે તેરાપંથી

જૈનિયોજના આર્તિમક ઉન્નતિનો વ્યાહર્ય ખહુ બુદ્ધી કેટીનો છે સંસારિક ઉન્નતિ કામી વ્યક્તિઓને તે ઉલ્લંઘ માલમ થાય પરંતુ ધર્મસુક્રિતનું સાધન છે અને સંસારથી સુક્રિત ખહુ ફર છે આ ખનેની તુલના કરેં. સંસારિક ઉન્નતિ અને મોાકની ઉન્નતિ, સંસારીક સુખ, મોાકીક સુખ જૈન ધર્મ અથવા કોઈ પણ મત જેમાં આત્માની સુક્રિતનો પંચ ખતલાંયો છે સંસારિક ઉન્નતિની પરીક્ષા કરે પરંતુ આ વાત જરૂર ધ્યાન રાખે કે મોાક પંચના પથિકની આર્તિમક શક્તિ હુશે તે હળરો, લાખો, કોડો, સંસારિક ઉન્નતિ પ્રયાસી વિષયલોગ લોલુપ મનુષ્યોમાં હોય તેના કરતાં હૃદયશક્તિ અનેકગુણી વધારે છે છતાં સામાયકમાં જે કાર્ય થાય તે મોાક સાર્ગ ન થાય તે સંસારનો માર્ગ દુંકામાં સમઝે.

નામ ધરાવે સાધુ જૈનના, વળી કહેવાય સુરીએશ
પાંચ મહુાવત લીધા પાળે નહિ, પાળે તેનાથી દ્વેષ
એવડા સુર્ખ પ્રભુએ કહ્યા, પ્રથમ આચારંગ હેઠ

શ્રી જૈન શ્વેતાંખર તેરાપંથી સમ્પ્રદાયનો ટુકો
ઈતિહાસ પહેલા આચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી
લીખણાલુસ્વામી મહુરાજ જૈન શ્વેતાંખર તેરાપંથી મતના
પ્રવર્તક પ્રાતસમરણીય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી લીખણાલુ
સ્વામી મહુરાજનો જન્મ અષાઢ સુદ ૧૩ સંવત ૧૭૮૮
જુલાઈ સને ૧૭૨૬ અન્નેલુચે મારવાડ કંટાલીઓ ગામમાં
થયો. પીતા ખલુલ સુખલેચા માતા દીપખાઈ ઓશવાલ

જાતીના લદ્ર પ્રકૃતિના અને જણ્ણા હુતા સ્વામી ભીખખુલુને
નાની ઉમરથી ધર્મની વિશેષ રૂચી હુતી માતાપીતા
ગંધીજીવાસીના અનુયાયી હુતા તેથી પહેલા આ સંપ્રદાયના
સાધુ પાસે આવવુ જવુ થયુ પરંતુ ત્યાં તરશ છીપાઈ
નહી તત્ત્વાનુસંધાનને માટે પોતીયાખંધ સાધુઓને ત્યાં
ગમનાનુગમન કરવા લાગ્યા ધણ્ણા ઢાડા તેના અનુયાયી
રહ્યા બાહ્યાડંમરની અધીકૃતા અને સાચા ધાર્મિક લગનનો
અલાવ માલમ પડયો તેને છોડી જૈન શ્વેતાંધર સ્થાનકવાસી
સંપ્રદાયની એક શાખા આચાર્ય શ્રી રૂધ્નાથજીથી
લક્ષ્મિલાવ કરવા લાગ્યા જેના હદ્દ્યમાં વૈરાગ્યની તીવ્ર
લાવના છે માટે જ્યાં સુધી તે લાવનાને અનુકૂળ સંગ
નહી મળે ત્યાં સુધી સાચા માર્ગના અનુસંધાન
કરતા રહે છે. હદ્દ્યની ‘લાવના જેટલી’ અધિક
તીવ્ર થાય છે અનુસંધાનનો વેગ પણ તેટલો જ જેરહાર
રહે છે સંસારના જેટલા મોટા મોટા દાર્શનિક, ધર્મ પ્રચારક
ત્યા વીજાન વેતા આહી થયા છે તેઓને પુર્ણ આત્મતૃપ્તિ
થઈ નહી ત્યાં સુધી પોતાના લક્ષ્ય તત્વગવેષણા કર્યા કરી
છે સ્વામીથી ભીખનું ને પણ તેમજ થયું સત્યની તપા-
શમાં હુતા જ્યાં સુધી તેઓના હુથમાં ન આવ્યું ત્યાં
સુધી તેના અનુસંધાનમાં લાગી રહ્યા..

જૈન ધર્મ એક વખત ખાડુ ઉન્નત ધર્મ હતો અને
રાજ્ય ધર્મ હોવાથી તે ભારત વ્યાપી થયો હતો એક
વખત જૈન ધર્મની વિજય ચારે ભાણુ ફેલાઈ હુતી
પરંતુ રાજનૈતિક ફેરફારથી તેના અનુયાયી ઓછા થતા

ગયા અને ધર્મ પ્રચારક સિદ્ધીલ થઈ ગયા લાકડામાં
ચુમાડો લાગવાથી જે પ્રકારે હુર થઈ શકતો નથી તેવી
રીતે પતન થવાથી ઉત્થાન માટે એક મોટી શકૃતીની જરૂર
હોય છે જૈન ધર્મના અલ્લાહુદ્દ્યથી વારંવાર મોટા સુધારક
ધર્મ પ્રચારકો મારફત પ્રયત્નો થાય છે સં. ૧૫૩૦ની
આશાપાશ શ્રી લુકાળ મહેતા નામના સહયોગસ્થ થયા
જેણે જૈન શાસ્ત્રો ને વાસ્તવિક રહુસ્ય અને અર્થનો પ્રચાર
શરૂ કીધો પરંતુ કેટલોક વખત બાદ તેના અનુયાયી કાલના
પ્રલાવથી શીથીવાચારી થયા તેની પરૂપણું પણ બદલાઈ ગઈ.
પછી લવળ નામે સાધુ શુદ્ધ પરૂપણું કરવા પ્રયત્ન કર્યો
પણ તે શાસ્ત્રીય આહેસો ને સર્વથા શાસ્ત્રીય રૂપમાં પ્રચાર
કે પાલન કરી શક્યો નહીં સાધુને માટે બનાવેલા મકા-
નમાં રહેવાવાલાને સ્થાનક વાંસી કહે છે એવા ઉદ્દેશીક
મકાનોમાં રહેવું જૈન શાસ્ત્ર મનાઈ કર્માવે છે લવળએ
સ્થાનક વાશ છોડી દીધો અને પુરેલા તુરેલા મકાન અર્થાત
હુઠોમાં રહેવું શરૂ કર્યું તેથી તેઓનો સંપર્દાય હુઢીયા
કરેવાવા લાગ્યા ધીમે ધીમે હુઢીયામાંથી ભાવીશ શાખા
એ થઈ એક શાખાવાલા ભીજાથી જુદા રહે છે કંઈક
કેરકાર સહીત ધર્મ પ્રચાર કરે છે તે ભાવીશ સંપર્દાયની
એક શાખા આચાર્ય રૂપનાથજીને ભીખણુણ એ પોતાના
પ્રથમ ચુરુ બનાવ્યા શરૂઆતમાં આવી રીતે જુદા જુદા
ધર્મસંપર્દાયોના સંસર્ગમાં આવવાથી અને જન્મથી વૈરાગ્ય
હોવાથી ભીખણુણના હુદ્દ્યમાં સંસાર ત્યાગ કરી સાધુ માર્ગ
સ્વીકાર કરવાની હૃદયા થઈ તે વૈરાગ્ય ભાવના અને

સાધુ થવાની મહુતાકંસાને એટલુ જેર પકડયું કે સ્વામી ભીખણુણ એ ગૃહસ્થાશ્રમમાં સર્વથા શીલ પાલવાવૃત્ત લીધુ સાથે એકાંતરા ઉપવાસ કરવા શરૂ કર્યા તેજ વખતે પોતાની સ્ત્રીનું દેહાવસાન થયું ભીખણુણનો વૈરાગ્ય લાવ. વઠવા લાગ્યો અને પુર્ણ યૌવનાવસ્થામાં છતાં ઘરવાલા. ની એક વાત સાંલળી નહી કરી પણુવાના સોંગંદ હતા.

હવે જલ્દીથી દીક્ષા લેવાનુ કલ્યું ભીખણુણના પીતાનુ દેહાવશાન એની વહુ પહેલા થયુ હતુ ફરત. માતાની આજા લેવાની હતી. .

ભીખણુણ જ્યારે ગર્ભાવસ્થામા હતા ત્યારે માતા. દીપાણાઈએ સિંહનુ સ્વર્ણ જેચુ હતુ તેથી માતાની ધારણું છોકરે પ્રતિષ્ઠ મહાપુરુષ થશે ! માટે પોતાના પુત્રની જોટી આશા રાખતી હતી ભીખણુણને દીક્ષા માટે. આજા લેવા પ્રસંગ આવ્યો ત્યારે એની માતાનો પ્રેમ. જાગ્યો સિંહ સ્વર્ણથી પુત્રની ભાવી મહાનતાના સુચક હતા તે આંખો સામે નાચવા લાગી જે માતા પોતાના પુત્ર માટે ઉચાશાપોષણ કરે છે અને તેના ભાવી એ સ્વર્યની કદ્યપના કરી પુલી સમાતી નથી તે માતા સામે. પુત્રના સંસાર ત્યાગના પ્રસ્તાવ આવ્યો ત્યારે તો પોતાની ખંડી આશાએ નિષ્કળ થતી જોઈ માતાના સ્નેહમય હૃદય વધારે નહીયાલિત થયુ અને પોતાના સ્વર્ણના હાલ કહેવા લાગી ને આજા ન આપી દીપાણાઈની વાત સાંલળી દ્વધનાથણાએ સમજવતા કલ્યું કે નિશ્ચય તાર્દ સ્વર્ણ સત્ય. સિદ્ધ થશે. અને ગૃહત્યાગી મુનિ થવાથી ભીખણ સિંહની

માર્કેક ગુંજથે દીપાબાધનિ રૂધનાથજીના આ જ્વાખથી સતોષ થયો અને પુત્રને દીક્ષા લેવા આજા આપી રૂધનાથજીએ સં. ૧૯૦૮માં સ્વામી લીખણુંને દીક્ષા આપી.

દીક્ષા પછીપ્રાય આડ વર્ષ લીખણું રૂધનાથજી પાસે રહ્યા અને એક વર્ષ અત્યંત અધ્ય વસાય અને એકાંત એકાંત એકાચચિત જૈન સુત્રના અધ્યયન અને મનનમાં લગાવ્યા શાસ્ત્રોનો ગંભીર અધ્યયનથી તેઓને માલમ પડ્યું કે તત્કાલીન સાધુ વર્ગ શાસ્ત્રીય આ દેશો સંપૂર્ણ પાલન કરતા નથી ને સાચી વાખ્યા કરતા નથી લીખણુંએ નેયું કે તત્કાલીન સાધુ પોતાને માટે બનાવેલા સ્થાનોમાં રહે છે ઉદેશિક આહુર લાવે છે લિક્ષાના નિયમોનો સમુચ્ચિત પાલન કરતા નથી પુસ્તકોનો સમુહ લાંબા કાળ સુધી વગર પડી લેહણ પડી રાખે છે દીક્ષા દેવા પહેલા માખાપ ખી પતી છેકરાની આજાની જરૂર સમજતા નથી વસ્તુ, પાત્ર ત્થા સાધુના ખીજા ઉપકરણ આવશ્યતા અને શાસ્ત્રીય પ્રમાણથી અધિક રાખે છે તેમાં સાચા આત્મદર્શન નથી અને શુદ્ધ સાધુ ચિત્ત આચાર નથી એ સર્વ લીખણું એ શાસ્ત્રો જોવાથી અને મંથણુથી ઝારી રીતે જાણી લીધું. રૂધનાથજીનો તેના ઉપર અધિક સ્નેહ હતો તે માટે ગુરુ સન્મુખ તેઓના સિથી-લાચારની વાત કહેવામાં લીખણુંને પહીલે પહુલ મુરકેલી અને સર્કેચ લાખ્યો. તથાપિ નાના પ્રકારની શંકાઓ ઉઠાવી પ્રક્રિયા કરતા ને સાચા રહુસ્ય જાણવા ઉત્કંઠા હેખા-

ડતા એટલામાં સંચોગવશ એવો બનાવ અન્યો કે પછી ભીખણુંણના લવીષ્ય ઉજવલ બનાવવા વાળી હતી.

મેવાડમાં રાજનગર જ્યાં વર્સ્તી સારી જાણુકાર હતી ત્યાં રૂધનાથજીના અયુયાથી ઘણ્ણા હતા તે અનુયાથીએમાં ઘણ્ણા મહાજન હતા અને ઘણ્ણાને કૈન શાસ્ત્રોના મર્મનુ જાન હતુ આ શ્રાવકેને કંઈ વાતમાં શંકા પડી તેઓએ રૂધનાથજી અને તેના સાધુએના આચાર શાસ્ત્ર સંમત ન લાગવાથી વંદના કરવી છોડી દીધી ભીખણુંણની ખુદ્દિ બહુ તિનિ હતી ખીજ પર તેઓની ખુદ્દિના તતકણુ પ્રલાવ પડતા હતા રૂધનાથજીએ આ શ્રાવકેની શંકા ફર કરવા ભીખણુંણને ચોઅય સમજી ખીજ સાધુ સાથે રાજનગર મોકલ્યા સ્વામીજીએ રાજનગરમાં ચોમાસુ કર્યું અનેક ચુક્તિએથી શ્રાવકેને સમજાવી કરી વંદના પ્રારંભ કરવી ! શ્રાવકે વંદના કરવા લાય્યા પણ હૃદયમાંથી શંકા નીકળી નહી અને ભીખણુંણની ચુક્તિથી તેઓના વૈરાગ્યમય જીવન અને સતમાર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞાના પ્રલાવથી શ્રાવકેએ વંદના શરૂ કરી તેજ રાત્રે ભીખનજીને અસાધારણ તાવ ચડ્યો તાવની તીવ્ર વેહનાએ ભીખનજીને પવિત્ર કરી દીધા !

તેઓએ બીચાંયું કે મે સત્યને ઝુંકુ ઠહેરાયું તે ઢીક નહી જે આ વખતે મારું મરણ થાય તો કેવી દુર્ગતિ થાય એવી રીતે આત્મજ્વાનિ અને પશ્ચાતાપથી તેઓના હૃદયના ખધા મલ ઢાવાઈ ગયા ને તેઓએ પ્રતિજ્ઞા કરી કે આ રોગથી મુક્ત થાઓ તો અવશ્ય પક્ષપાત રહીત

થઈ સાચો માર્ગ અનુસરણ કરુ જીનેકત સાચા સિદ્ધાંતોએ
ને અંગીકાર કરી તેના અનુસાર આચરણ કરવાથી કોઈની
ખાતર નહીં કરીશ આ પ્રકારનો એક દીવ્ય પ્રકાશથી
તેઓના હૃદય જગમયા ખાદ તેઓનું બધું જીવન આવા
આંતરીક પ્રકાશથી આવોકિત છે.

એ સ્વામીજીની અસાધારણ મહાનતાના લક્ષણ છે
તેઓમાં હડ કે જીદ ન હતી પોતાની ભુલ થવાથી છુપા-
વતા કે પોષણ કરતા નહીં એક સાચા સુસુક્ષુની માર્કે
સત્યની તપાસમાં હતા જ્યાં સત્યના દર્શન થતા લ્યાં
આગળ વઢતા એહીકમાન સન્માન કે પદની ગૌરવની
રક્ષાનો ખ્યાલ જરા પણ નહોતો.

સત્ય માટે સર્વ વાત ગણુતીમાં નહુતી. માટે જ્યારે તે
વખતના સાધુ સમાજમાં શિથીલાચાર માલમ પડ્યો તે
વખતે તેઓએ તેનું પ્રાયશ્ક્રિત કીધું.

ઉપરેક્ત પતિજા પછી લીખણુંનો તાવ ઉત્તરી
ગયો તેઓએ શ્રાવકોને કલ્યું કે તમારું કહેવું સાચું છે
સાધુ વર્ગના આચાર પડુપણું અશુભ છે તેઓએ વચન
આખ્યું કે આચારને સમજાવી શુદ્ધ માર્ગની પ્રવૃત્તિ
માટે ચેષ્ટા કરીશ તેથી શ્રાવક વિશેષ શ્રદ્ધાળું થયા તેઓએ
સત્યાસત્યનો નિર્ણય કરવા ફરીથી શાસ્ત્રો વાંચ્યાં બત્તીશ
સુત્રો એ એ વખત સારી રીતે વિચારપૂર્વક વાંચ્યા હુવે
દ્વિનાથજીનો પક્ષ શાસ્ત્ર સંભત ન હોવાની શંકા ન રહી.

લીખણું જીનેકત માર્ગ અંગીકાર કરવાની પ્રતિજા
કરી લીધી હતી તેથી પાઠક એમન સમજે કે તેઓ

એ રૂધનાથજીના શિષ્ય ન રહેવાની અને કોઈ નવો પંથ મત સ્થાપી આચાર્ય બનવા ચાહુતા હતા જ્યાં સાચો માર્ગ હો ત્યાં ગુરુ રૂપમાં કે શિષ્ય રૂપમાં રહેવુ તેઓને માટે સમાન હતુ આત્મા કલ્યાણનો માર્ગ મુખ્ય હતો એટલે શિષ્યરહીને પણ પ્રાપ્ત કરી શકે માટે રૂધનાથજીનીપક્ષને બુલ ભરેલી સમજ તેઓએ તેજ વખતે રૂધનાથજીથી પોતાનો સંબંધ તોડયો નહી પણ ઉલ્લટો તેઓએ રૂધનાથજીથી શાસ્ત્રીય આલોચન કરવા વિચાર કીધો પોતાના સંપ્રદાયને શુદ્ધમાર્ગ પર લાવવા પ્રયત્ન કીધો તેઓને મળવા પહેલા પોતાના લવિષ્ય સંબંધમાં તેઓએ કોઈ નિશ્ચય કર્યો નહી આ વખતે ભીખણુંઝુંએ જે જે વિનય અને ધીરજનો પરિચય દેખાડ્યો છે તે તેઓના આંતરિક વૈરાગ્ય અને ધર્મભાવનાના પ્રતિબિમ્બ્ય છે.

ચોમાસુ ખલાશ થયે ભીખણું રૂધનાથજીની પાશ ગયા અને નભ્રતાપૂર્વક આલોંચના શરૂ કરી તેઓએ કહ્યું કે હુમે કલ્યાણ માટે ધરખાર છોડ્યા છે તો જુઠી પક્ષપાત છોડી સાચો માર્ગ ચહુણ કરવો જોઈયે શાસ્ત્રીય વચ્ચેનોના પ્રમાણ માનકર મિથ્યા પક્ષ ન રાખવો જોઈયે પુન પ્રશંસા તો ઘણી વખત મળી છે પણ સાચો માર્ગ મળવો બધું કઠણું છે સાચા માર્ગ પ્રાપ્ત કરવામાં આ વાતોનો હીસાખ ગણુંવો જોઈયે નહી તમને આમાં કંઈ સહેલ રહેવો જોઈયે નહી જે આપ શુદ્ધ જૈન માર્ગ ને અંગી-કાર કરો તો મારે માથે આપ પહેલા પુન્ય રહેશો.

પરંતુ લીખણુણુની આ નમ્ર વીનતીનો રૂધનાથજી ઉપર કોઈ અસર થઈ નહી પાંચમા આરાનો પ્રલાવ કહી વાત ઉડાવી દીધી સ્વામી લીખણુણ આ ઉત્તરથી સતોષ થયા નહી તેની નજરમાં આ હુઃખમ કાળમાં સમ્યક્ત્વ પાલન કરવાવાના ઉધમમાં ઓછું આવવાને બદલે અધિક ઉત્તર આવવી જોઈએ ભગવાને જે પાચમા આરાને હુઃખમ કાળ બતલાવ્યો તેનુ તાત્પર્ય એ નથી કે કોઈ કાળમાં કોઈ સમ્યક ધર્મનુ પાલન નહી કરી શકશે પણ તેનો અર્થ એ છે કે ચરિત્ર પાલનમાં નાના પ્રકારની શારીરિક ર્થા માનસિક કઠિનાઈ આવશે માટે ચારીત્ર પાલવા વધુ મુર્ખાર્થની જરૂર છે લીખણુણએ ભગવાનનુ ફરમાન વાંચી દીધુ જે શક્તિહીન હુશે અને સાધુપણુ પાલવામાં અસમર્થ હુશે તે વખતનો આરાનો દોષ બતલાવશે ને શિથીલાચાર છોડશે નહી.

ગુરુ રૂધનાથજીને દરેક પ્રકારની ચેષ્ટા કરી ઢીકસર ન ચાલવાથી સ્વામીજી પોતે તેનાથી જુદ્દા થયા અને શુદ્ધ સંયમ માર્ગ પર ચાલવા દ્વદ્દ નિશ્ચય કર્યો, લીખણુણએ બગડી શહેરમાં રૂધનાથજીનો સંગ છોડી દીધો અને તેનાથી જુદ્દો વીહાર કીધેલ.

ભારમતજી વીગેરે કેટલાક સંત તેઓ સાથે થયા આવી રીતે ગુરુ રૂધનાથજીથી જુદ્દા થઈ હુઃખના દુગર અમ્યા તે વખતે રૂધનાથજીની પ્રતિષ્ઠા સારી હતી તેના શ્રદ્ધાળુ ભક્તો ધણ્યા હતા લીખણુણ જુદ્દા થતાની સાથે રૂધનાથજીએ બહુ વિરોધ કર્યો પરંતુ લીખણુણ તે સર્વથી

ચલિત થયા નહી અગડીમાં ભીખણુલુને સ્થાન આપવું
નહી એવી હાંડી પીઠાવી ભીખણુલ સાધુએ માટે બના-
વેલા આધાકર્મી સ્થાનકનો આશ્રય ન લીધો પણ અગડી
બહુર કૈતસીહુલુની છત્રીમાં રહ્યા ત્યાં રૂધનાથજીએ વળી
નેરથી ચર્ચા કરી નાના પ્રકારના ઉપાય કર્યા સ્વામીજી
તેઓના સામીલ ન થયા રૂધનાથજી ભીખણુલુને કેરી
પોતાની સાથે લઈ જઈ શક્યા નહી ત્યારે રૂધનાથજી બોલ્યા
કે હું તારા પગ જમવા દઈશ નહી તું જ્યાં જશો ત્યાં
તારો પીછો છોડીશ નહી અને તારો ઘોર વીરોધ કરીશ
આ ધમકિયેને ભીખણુલ એ જરા પણ ગણુકારી નહી
ને અગડીથી વીહુર કીધો વીહુર કરતા ભીખણુલ નેધપુર
પધાર્યા ત્યાં પહોંચતા પહોંચતા સ્વામીજીના અનુયાયી તેર
સાધુ તેમાં પાંચ રૂધનાલુના છ જેમલજીની સંપ્રદાયના
અને એ ખીજ તેમાં ટોકરજી, હરનાથજી, લારીમલજી,
વીરલાણુલ સામીલ હતા આ લગી તેર શ્રાવક ભીખણુલના
પક્ષમાં હતા નેધપુરના બજારમાં એક ખાલી હુકાનમાં
શ્રાવકો સામાયક કરતા ત્યા પોષાદિક કરતા જેયા તે
વખતે નેધપુરના દીવાન ઇતેહચંદજી સીધીનું બજારમાંથી
જવું થયું સાધુ માટે નિદિષ્ટ સ્થાન છોડી બજારમાં
ચૌટામાં સાધુ શ્રાવકોને સામાયિક વીરે ધર્મકૃત્ય કરતા
નેઈ આશ્ર્ય થયા તેઓના પુછવાથી શ્રાવકોએ રૂધના-
થજીથી ભીખણુલનું જુહુ પડવું બતલાયું.

જૈન શાસ્ત્રોની દર્શિયે પોતા માટે બનાવેલા મકા-
નમાં સાધુએ ન રહેવુ નેઈએ એ સમજન્યુ દીવાન

ફેચંદજીએ પુછ્યું કે ભીખણુણના તેર સાધુ તેર શ્રાવક
છે ત્યાં ઉલેલો સેવક કવિએ હોહરો જેડી તેરાપંથી
નામથી સંઘોધ્યા.

શામીલું પ્રત્યુત્પન્ન મતિ બહુ આક્ર્યકારી હતી
તેમના જેવી ઉત્પાત બુદ્ધિ ચોડામાં હોય છે તે સેવક કવીના
મોઢેથી આકસ્મિક “તેરાપંથી” નામ સાંલળી સ્વામીલુંએ
તેનો બહુ સુંદર અર્થ કર્યો પાંચ મહાત્રત, પાંચ સુમતી
અને ત્રણુ ગુણિત શામી શ્રી રીખવ દેવ લગવાનના વખ-
તથી જે પાળે છે તેજ હેપ્રલુટેરાપંથ છે બાકી અનેરા-
પંથી છે.

આ ઘરના બાદ શાં. ૧૮૧૭ના અષાઢ સુદ ૧૫ને
દીને સ્વામી ભીખણુણએ લગવાનની સાક્ષીએ નવી દીક્ષા
લીધી અને તેઓની સાથેના સાધુઓને જે જગ્યાએ તેઓ
ચોડાસુ કરે ત્યાં દીક્ષા લેવા કહી દીધું ચોડાસુ ઉત્તર્યા
પણી બધા સાધુ લેગા થાય તેઓની શ્રદ્ધા આચાર આપ-
સમાં મળે તે સામેલ બાકી જુદા એવી રીતે તેરાપંથી
મતની સ્થાપના જાહેર થઈ ને હુમેશ બુદ્ધિ થઈ.

આ મત સ્થાપના જાહેર થઈ આગળ માર્ગ સરળ નહોતો
રૂધનાયળું પુષ્કળ જેરથી બોકેને લડકાવવા લાગ્યા રહેવાને
જગ્યા મળતી નહી ધી હુધની વાત હુર રહી પણ લુખા
સુકા આડુર પણ પુરા મળતા નહી પીવાને પાણી માટે
કંપ ઉડાવવું પડતું પણ શામીલું આ વિધન બાધાએથી
ગલરારા નહી તંચ્યાએ એવો વીચાર કર્યો કે પોતાના માર્ગ
નિર્ધિત કર્યો હતો તેને માટે પ્રાણુ જય તેની દરકાર ન

હતી સ્વામી જીતમલજીને ઠીક કહ્યા હે કે “મરણુધાર
શુદ્ધમગ લિયો” અર્થात તેઓએ પ્રાણ હેવા સુધી
નિશ્ચય કર્યો હતો ને પ્રલુનો સાચો માર્ગ અંગીકાર કર્યો
હતો આવી કઠીનાઈએ એક દહાડા, એ દહાડા નહી પણ
હમેશ કઈ વર્ષો સુધી સહેવી પડી હતી પણ રમામીળુએ
તેની કઈ પણ દરકાર કરી નહી

આવા પરિષ્ઠા સમભાવે સહન કરતા તેઓએ જેયુ
કે લોકો જૈન ધર્મથી ધણ્ણા દુર છે ધણ્ણા લોકો ચાલુ
ચીલે ચાલવાવાળા છે સત્યાસત્યનો નિર્ણય કરવા અસર્મથ છે
જીબ વરણી કર્મનુ જેર છે સમજવા બનુ કઠણુ છે ધર્મના
ફ્રેન્ઝો ધણ્ણા છે સમજહારે થોડા છે એવી સ્થીતીમાં ધર્મ
પ્રચાર થઈ શકે નહી માટે આત્મકલ્યાણનો ઉદ્ઘોગ કરીયે
ઘર છોડી આ કઠિન માર્ગ સાધુ સાધિયોને દીક્ષા લેવી
કઠણુ છે માટે ઉચ્ચ તપસ્યા કરી મારે આત્મોધાર કરવો
આવો વિચાર કરી તેઓએ એકાંતર વ્રત કરવા શરૂ કર્યા
તડકામાં આતાપના લેવી શરૂ કરી ખીજ સાધુએને પણ
લીખણુણુએ તેમ કરવા કણું એવી રીતે સ્વામીજી પો-
તાના પ્રકાશેલા મત રૂપી વૃક્ષને તપરૂપી પાણીથી સીચવા
શરૂ કર્યા લીખણુણના સમયમાં શ્રી થીરપાલજી અને શ્રી
કૃતેહુચંદ્રજી એ સાધુ હતા તે તપસ્વી, શરળલદ્ર પ્રકૃતિના
હતા તેઓએ લીખણુણને આવી ઉચ્ચ તપસ્યા કરતા જોઈ
અરજ કરી કે આવી રીતે તપસ્યા કરી શરીર ખપાવો
તેના કરતા ધણ્ણા લોકો આપને હાથે સમજે એમ છે
આપની ખુદ્દી અસાધારણ છે આપમાં પોતાનું કલ્યાણ

સાથે સાથે ખીનાનુ કલ્યાણ કરવા સામર્થ્ય છે માટે આ-
પની ખુખ્ખિનો શક્તિનો ધણા લોકેને સમજવવા ઉપરોગ
કરો આ વૃયોવૃખ સાધુઓની વીનંતી ભીખણુણુચે સ્વી-
કારી ત્યારથી ધાર્મિક સીદ્ધાંત લોકોમાં પ્રચારવા માંડયો।
આ સિદ્ધાંત હાળોમાં લખી લખી શાસ્ત્રીય હાખ્લા
સહીત બતાવ્યા ન્યાય અને વર્ક દ્વારાથી તેઓએ હ્યા-
દાન ઉપર સુંદર ઢાલ બનાવી મત અવત ખુઅ સમજાવ્યા
નવ તત્વો ઉપર એક મહત્વપૂર્ણ પુસ્તક લખી શ્રાવકના
ખાર મત ઉપર નવો પ્રકાશ નાંખ્યો। શીયત્વ ખડુમર્યના
વિષય ઉપર મહત્વપૂર્ણ રચના કરી એવી રીતે પોતાના
વિચાર લોકેને સમજાવ્યા સાધુના આચાર પર દ્વારા
બનાવી સીથીલાચાર હુરાવ્યો સાચુ સાધુપણુ લોકેને
બતાવ્યું મનની તમામ ધારણા શાસ્ત્રીય મત મુજબ
બધાને બતલાવ્યા પોતાના મતની પુણી કરી જે મત
તેર સાધુ અને તેર શ્રાવકોથી શરૂ કર્યા તે ફેલતા ફેલતા
લાઘોની સંખ્યામાં રજુપુતાના, બંગાલ, આસામ, પંજાબ
માળના, ખાનદેશ, ગુજરાત, મુખ્ય, દક્ષીણ મદ્રાસ, હરીયાના
સર્વ સ્થાનમાં ફેલાયો।

ભીખણુણુનો ધર્મ પ્રચાર મારવાડ, મેવાડ, હુંદાડ
કુચ્છ વીગેર પ્રદેશમાં હતો કુચ્છમાં સ્વામીણુનો વીહાર
થયો નહોતો પણ શ્રાવક ટીકમડોશી મારક્ત પ્રચાર થયો।
હતો ભીખણુણુએ પોતે ૪૮ સાધુને ૫૬ સાધ્વિઓને
દીક્ષા આપી તેમાંથી ૨૦ સાધુ ૧૭ સાધ્વ આવા
ચખત સાધુ ધર્મ ન પાળી શકવાથી નીકદી ગયા શ્રાવક
અને શ્રાવીકાની સંખ્યા બહુ વધી ગઈ સ્વામીણુના મત

પ્રચારની સક્રિયતા પોતે જેઈ સ્વામીજીના દેહાબસાન શાં
 ૧૮૬૦ લાહરવા સુદ ૧૩ એ સીરીયામાં થયો છેવટ સુધી
 જગરુતા રહી છેલ્લા દીવસોમાં ને ઉપદેશ આપ્યો તે
 સ્વર્ણ અક્ષરોમાં લખવા ચોભય છે ૪૪ વર્ષમાં નીચે
 મુજબ ચોમાસા કીધા.

કેળવામાં છ ૧૮૧૭, ૨૧, ૨૫, ૩૮, ૪૬, ૫૮
 ખરોલીમાં એક ૧૮૧૮

સીરીયામાં સાત ૧૮૧૯, ૨૨, ૨૬, ૩૬, ૪૨, ૫૧, ૬૦
 રાજનગરમાં એક ૧૮૨૦

પાદીમાં સાત ૧૮૨૩, ૩૩, ૪૦, ૪૪, ૫૨, ૫૫, ૫૮
 કંટાલીયા એ ૧૮૨૪, ૨૮

ઘેરવે પાંચ શાં. ૧૮૨૬, ૩૨, ૪૧, ૪૬, ૫૪
 ખગડીમાં ત્રણુ શાં. ૧૮૨૭, ૩૦, ૩૬

રણુત લંવરગઠમાં એ શાં. ૧૮૩૧, ૪૮
 પીપાડમાં એ શાં. ૧૮૩૪, ૧૮૪૫

આમેટમાં એક શાં. ૧૮૩૫
 પાહુમાં એક શાં. ૧૮૩૭

નાથકારામાં ત્રણુ શાં. ૧૮૪૩, ૫૦, ૫૮
 પુરમાં એ શાં. ૧૮૪૭, ૫૭

રોજતમાં એક શાં. ૧૮૪૯

ખીલ આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી
 ભરમનજીનાની આપ ઓશવાદ લોદાગોત્ર પીતા કૃષ્ણાંજ
 મજ્જા ધારી હી જન્મ ગેતુડ મેહી ગાં શા. ૧૮૦૩નાં
 અથ્વા આપની દીક્ષા નાની ઉમરમાં સ્વામી શ્રી ૧૦૦૮ શ્રી

લીખનજુ સ્વામીને હુણે દીક્ષા શં. ૧૮૧૭ના અષાઢ
સુદ ૧૫એ લીધી સ્વામી શ્રી લીખનજુસ્વામીએ પોતે
યુવરાજપદ આપ્યુ શં. ૧૮૬૦ લાદરવા સુદ ૧૫ને રોજ
આચાર્યપદે ખીરાન્યા ઉટ સાધુ ૪૪ સાધ્વીને દીક્ષા આપી
સ્વર્ગવાસ શં. ૧૮૭૮ માઘ વહ ૮એ મેવાડમાં રાજનગરમાં
થયો સ્વર્ગવાસ સમય ૩૫ સાધુ ૪૧ સાધ્વી આજામાં
હુતી આપને અઠાર વર્ષમાં નીચે મુજબ ચોમાસા કીધા.

પાસાગળુમાં એક શં. ૧૮૬૧

પાલીમાં ત્રણ શં. ૧૮૬૨, ૬૮, ૭૨

ઝેરવામાં એક શં. ૧૯૬૩

કેલવામાં ઐ શં. ૧૮૬૪, ૭૮

નાથદ્વારમાં ત્રણ શં. ૧૮૬૫, ૭૪, ૭૫

આમેરમાં એક શં. ૧૮૬૬

ખાલોતરામાં એક શં. ૧૮૬૭

જેપુરમાં એક શં. ૧૮૬૮

માધુપુરમાં એક શં. ૧૮૭૦

ઓરાવડમાં એક શં. ૧૮૭૧

સીરીયામાં એક શં. ૧૮૭૩

કાકરોહીમાં એક શં. ૧૮૭૪

પુરમાં એક શં. ૧૮૭૬

ત્રીજ આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી રાયચંદુજ
સ્વામી

ઓશનાત બમ્બ જોત્ર પીતા ચતુરજ માતા કુશ-
વાજુ જન્મ મેવાડ ગામ રાવલિયામાં શં. ૧૫૪૪માં થયો.

નાની ઉમરમાં શ્રીમહ લીકુ સ્વામીના શાશન કાળમાં મીતી ચૈત્ર સુદ ૧૫ શાં. ૧૮૪૭માં દીક્ષા લીધી શાં. ૧૮૭૮ ભાડરવા વદ ૯ એ આચાર્યપદ પામ્યા પોતે ૭૭ સાધુ ને ૧૬૮ સાધ્વીને દીક્ષા આપી સ્વર્ગવાશ શાં. ૧૬૦૮ માગશર વદ ૧૪ એ રાવલીયામાં થયો સ્વર્ગવાશ સમય ૬૭ સાધુ ને ૧૪૪ સાધ્વી આજામાં હુતી ત્રીશ વર્ષમાં નીચે મુજબ ચોમાશા કર્યા.

પાલીમાં આડ શાં. ૧૮૭૬, ૧૮૮૨, ૮૬, ૯૦, ૯૩, ૯૬, ૧૬૦૨, ૧૬૦૫

જેપુરમાં ૭ શાં. ૧૮૮૦, ૯૨, ૯૭, ૧૬૦૦, ૧૬૦૩, ૧૬૦૭

પીપાડમાં એક શાં. ૧૬૮૧

ઉદેપુરમાં ચાર શાં. ૧૮૮૩, ૮૬, ૯૪, ૧૬૦૮

પટલાવદમાં એક શાં. ૧૬૮૪

નાથદ્વારામાં પાંચ શાં. ૧૬૮૫, ૮૮, ૯૪, ૧૬૦૧, ૧૬૦૪

ખીદાસરમાં ઐ શાં. ૧૮૮૭, ૧૮૯૯

ગોગુનદામાં એક શાં. ૧૮૯૧

લાડનુનમાં ઐ શાં. ૧૮૭૮ ને ૧૬૦૬

ચાથા આચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી જીત-મહાલુ શામી આપ ઓશવાલ ગોલેચ્છ પીતા આઈ દાનલુ માતા કલુલુ જન્મ મારવાડ રોહીત ગામ શાંવત શાં. ૧૮૬૦ આસો સુદ ૧૪ નાની ઉમરમાં પોતાની માતા પોતાના ઐ લાઇઓ સાથે શાં. ૧૮૬૫ માઘ વદી ૭ ને

દીને જેપુરમાં દીક્ષા લીધી શાં. ૧૯૦૮ મીતી માઘ સુહ
૧૫ ને દીને પાટ ખીરાન્યા પોતાને હુએ ૧૦૫ સાધુ ને
૨૨૪ સાધીઓને દીક્ષા આપી સ્વર્ગવાશ જેપુરમાં શાં.
૧૯૩૮ લાહરવા વદ ૧૨ એ થયો સ્વર્ગવાશ સમયે ૭૧
સાધુને ૨૦૫ સાધી આજામાં હુતી ત્રીશ વર્ષમાં નીચે
મુજબ ચોમાશા કર્યો

જેપુરમાં ચાર શાં. ૧૯૦૯. ૧૯૨૮. ૧૯૩૭. ૧૯૩૮.

ઉદેપુરમાં એક શાં. ૧૯૧૦

રતલામમાં એક શાં. ૧૯૧૧

નાથક્ષારે એક શાં. ૧૯૧૨

પાલીમાં ઐ શાં. ૧૯૧૩ શાં. ૧૯૨૨

ખીધસરમાં આઠ શાં. ૧૯૧૪. ૧૯૧૭. ૧૯૨૩.

૧૯૨૬. ૧૯૨૬. ૧૯૩૦. ૧૯૩૫. ૧૯૩૬

લાડનુનમાં છ શાં. ૧૯૧૫, ૧૯૧૮, ૧૯૨૭, ૧૯૩૨,
૧૯૩૩, ૧૯૩૪

સુનનગઠમાં ચાર શાં. ૧૯૧૬, ૧૯૧૬, ૧૯૨૪,
૧૯૩૧

ચુરમાં એક શાં. ૧૯૨૦

નેધપુરમાં ઐ શાં. ૧૯૨૧, ૧૯૨૫

પાંચમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી મધરા-
જળ સ્વામી.

આપ એશવાલ એગવાની જોત્ર પીતા પુરણુમલજી
માતા બન્નાજી જન્મ થલી પ્રદેશ ખીદાસર ગામ શાં.
૧૮૬૭ ચૈત્ર સુહ ૧૧એ થયો હુતો આપ દીક્ષા નાની

ઉંમરમાં શાં. ૧૯૦૮ માગશર વહ ૧૨એ લાડનુનમાં થઈ શાં. ૧૯૩૮ની ભાદરવા સુદ રએ આચાર્ય થયા આપને ૩૬ સાધુને ૮૩ સાધ્વીઓને દીક્ષા આપી આપ શાં. ૧૯૪૬ ચૈત્ર વહ દ્વાચે સરદાર શહેરમાં સ્વર્ગવાશ થયો સ્વર્ગવાસ સમય ૭૧ સાધુ ૧૫૩ સાધ્વી આપની આજામાં હતા નીચે લખેલા ગામમાં અગીઆર ચોમાસા કર્યા.

ખીદાસરમાં ત્રણુ શાં. ૧૯૩૬, ૧૯૪૪, ૧૯૪૭

ચુઝમાં એક શાં. ૧૯૪૦

સરદાર શહેરમાં ઐ શાં. ૧૯૪૧, ૧૯૪૫

નેધપુરમાં એક શાં. ૧૯૪૨

ઉદ્દેપુરમાં એક શાં. ૧૯૪૩

લાડનુમાં એક શાં. ૧૯૪૬

નેપુરમાં એક શાં. ૧૯૪૮

રતનગઢમાં એક શાં. ૧૯૪૯

ઇન્દ્રી આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી
માનેકલાલળુસ્વામી

આપકા જન્મ શ્રીમાલી ખારેડ ગોત્ર પીતા હુકમ-
ચંદ્ર માતા છોટાળ હુઠાડ પ્રહેશ નેપુર શહેરે શાં.
૧૯૧૨ ભાદરવા વહ ૪ને દાઢાડે થયો હતો આપની દીક્ષા
ખાલવયમાં લાડનુનમાં શાં. ૧૯૨૮ ફાગણુ સુદ ૧૧એ થઈ
સરદાર શહેરમાં શાં. ૧૯૪૬ ચૈત્ર સુદ ૮એ આચાર્યપદ
મલ્યુ સોળ સાધુ ને ચોવીશ સાધવીને દીક્ષા આપી
આપનો સ્વર્ગવાશ ૧૯૫૪ ડારતક વહ ઉને રેજ સુભાન-
ગઢમાં થયો આપના સ્વર્ગવાશ સમય ૭૨ સાધુ ૧૬૪

સાધી આ આજામાં હુતી પાંચ વર્ષના કાળમાં નીચે
મુજબ ચોમાસા કર્યા.

સરદાર શહેરે એક શા. ૧૯૫૦

મુરુમાં એક શા. ૧૯૫૧

જેપુરમાં એક શા. ૧૯૫૨

ભીદાસરમાં એક શા. ૧૯૫૩

સુજાનગઢમાં એક શા. ૧૯૫૪

સાતમા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી
ડાલચંદજી શામી

આપ વીશાઓશવાલ પીપાડાગોત્ર પીતાનું નામ
શા. કનીરામજી માતા જડાવાળુ માળતામાં ઉજાગેન ત્રા-
મમાં શા. ૧૯૦૬ના અપાઠ સુદ ઈનો દીવસે જન્મ થયો
નાની ઉમરમાં ૧૯૨૩ લાદરવા વહ ૧૨ને રોજ ઈદ્હોરમાં
દીક્ષા થઈ શા. ૧૯૫૪ મહાં વહ ૨ને દહુાડે આચાર્યપદ
શોભાધ્યુ આપે ઉદ્ઘાટન ૧૨૫ સાધીયોને દીક્ષા આપી
આપનો સ્વર્ગવાસ લાડનુનમાં શા. ૧૯૬૬ લાદરવા માશમાં
થયો સ્વર્ગવાસ સમય ૬૮ સાધુ ને ૨૩૧ સાધીયો
આજામાં હુતી નીચે મુજબ ગામોમાં ચોમાસા કર્યા

લાડનુનમાં ચાર શા. ૧૯૫૫, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૬૬

સરદાર શહેરે ઐ શા. ૧૯૫૬, ૧૯૬૩

ભીદાસરમાં ઐ શા. ૧૯૫૭, ૧૯૬૪

રાજલદેશર એક શા. ૧૯૬૮

જેધપુરમાં એક શા. ૧૯૫૬

સુજાનગઢમાં એક શા. ૧૯૬૦

ચુડમાં એક શાં. ૧૯૬૧

આડમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કાદુરામ:
શ્વામી

આપ વીશા ઓષ્ઠવાલ ડેઢારી ગોત્ર પીતાજી શા.
મુલચંદજી માતા છોગાળુ જન્મ થલી પ્રાંતમાં છાપર નામે
ગામ શાંવત ૧૮૭૩ ફ્રાગણ સુદ ૨ દીક્ષા મેઘરાજજી શ્વામી ને
હાથે નાની ઉંમરમાં પોતાથી માતા મહાસતીલુ છોગાળુ.
ને મારીની બેટી કાનકુંવરજી સાથે શાં. ૧૯૪૪ આસો સુદ ૩
ખીરાસરમાં થઈ પુજ્યજી શ્રી શ્વામી ડાલચંદજી સ્વર્ગવાસ
થયા પછી શાં. ૧૯૬૬ ભાદરવા સુદ ૧૫ દીન આચાર્યપદ ઉપર
ખીરાન્દ્યા પોતે ૧૫૫ સાંધુ ને રૂપ્ય સાધવીએને દીક્ષા આપી
આપનો સ્વર્ગવાશ શાં. ૧૯૬૩ મીતી પ્રથમ ભાદરવા શુદ્ધ
૬ એ ગંગાપુરમાં થયો સ્વર્ગવાસ સમય ગણુમાં ૧૩૮
સાંધુ ને ૩૩૪ સાધવીએ હતી આપને ૨૭ વર્ષ આચાર્ય
પદ પર ખીરાન્દ્યા નીચે સુજળાં ચોમાશા કીધા.

લાડનુનમાં ત્રણુ શાં. ૧૯૬૬, ૧૯૭૦, ૧૯૮૬

સરદાર શેરોફર ત્રણુ શાં. ૧૯૬૭, ૧૯૭૪, ૧૯૮૫

ખીરાસર ચાર શાં. ૧૯૬૮, ૧૯૭૬, ૧૯૮૨, ૧૯૮૮

ચુડમાં એ શાં. ૧૯૬૬, ૧૯૮૧

સુભાનગાઠ એ શાં. ૧૯૭૧, ૧૯૬૦

ઉદ્દેપુર એંશાં. ૧૯૭૨, ૧૯૮૨

નેધપુર એ શાં. ૧૯૭૩, ૧૯૬૧

રાજલહેશર એક શાં. ૧૯૭૫

લીવાની એક શાં. ૧૯૭૭

રતનગઢ એક સં. ૧૯૭૮

ખીડાનેર એક સં. ૧૯૭૬

જેપુર એક શા. ૧૯૮૦

ગંગા શેહેર એ શા. ૧૯૮૩, ૧૯૮૭

કુગરગઢ એક શા. ૧૯૮૪

છાપર એક શા. ૧૯૮૫

ગંગાપુર ૧૯૮૩

માણ મહારાજ શ્રી છોગાળ ખીદાશરમાં ૮૬ વર્ષની
વયે ખીડાનેર જીવ્લામાં એકાંતરા છઠ અઠમ તપ કરી
કાયા શોશવી દેવલોક પધાર્યા.

જૈન સાહિત્યમાં સંસાર ગ્રસિદ્ધ ડા-હુરમન જેકોખી
જરમન દેશવાસી ચિકાગો અમેરિકા યુનિવર્સિટીના અધ્યાપક
જે કલકત્તા વિશ્વવિદ્યાલયમાં જૈન દર્શનના અધ્યાપક ધણ્ણા
વર્ષોથી હૃતા તે આપના દર્શને આવી શાસ્ત્રોના રહુસ્થે
સમજ્યા હતા લાલા સુખવીરસીહુળ મેમ્બર હીંદુસ્તાનની
ધારાસલા રાજલદેશરમાં ને ખીયાવરમાં એ વખત દર્શન
કર્યા હતા ચીકાગો અમેરિકા યુનિવર્સિટીના અધ્યાપક ડા.
ચાર્લિસ ડાખ્લુ ગીલ્કીએ આપના દર્શન કરી તત્ત્વ સમજ્યો
હતો અને અને તેરાપથી ધર્મના સિદ્ધાંત અને સાધુના
આચાર નીયમો લારત, યુરોપ, અને અમેરિકાના પોતાના
મિત્રો પાસે જણ્ણાવવા કહેતો હતો વગેરે ધણ્ણા વીદ્ધાનેએ
દર્શન કર્યા હતા.

નવમાં વર્તમાન આચાર્ય શ્રી શ્રી ૧૦૦૮
શ્રી શ્રી તુલશી રામલુસ્વામી પોતે વીશા ઓશવાલુ

ખટેડ જોત્ર પીતા શા. જુમરમળજ માતા શ્રી બહનાજ જનમ
મારવાડ પ્રાંત લાડનુન શહેરે શા. ૧૯૭૧ કારતક સુદ રનો
જનમ શા. ૧૯૮૨ પોશ વદ પણે દીક્ષા, યુવરાજ પહવી આઠમા
આચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કાલુરામજીદારા શા.
૧૯૮૫ના ભાદ્રવા સુદ ત એ મદ્વી આઠમા આચાર્યના સ્વર્ગ-
વાસ પછી શા. ૧૯૮૬ વરખે ભાદ્રવા સુદ હને દીવસે આચા-
ર્યપદ પર ખીરાન્યા પછી હુમણું સુધી શા. ૧૯૮૫ માઘ
સુધી ૧૫ સુધી ૨૫ સાધુ ને પદ સતીજીઓને દીક્ષા આપી
૧૫૧ સાધુને ૪૦૨ મહાસતીજ આપની આજામાંથી
ઉપરોક્ત નવ આચાર્યમાં આ આપે આવી નાની ઉમરમાં
આચાર્યનો શુદ્ધભાર મેળવ્યો આપે આ નાની ઉમરમાં જે
પાંડીત્ય, વિદ્વતા, વૈરાણ્ય વસંધ પરિચાલન શકતી છે તે
અસાધારણ છે પોતે પાટ ખીરાન્યા પછી—

ગંગાપુરમાં એક શા. ૧૯૮૮

ખીકાનેરમાં એક શા. ૧૯૯૪

સરદાર શહેરમાં એક શા. ૧૯૯૫

ખીદાસરમાં એક શા. ૧૯૯૬

લાડનુનમાં એક સં. ૧૯૯૭

તેરાપંથી મુર્તિપુજા કરે નહિ અને મોક્ષનું સાધન
માને નહિ શ્રી તીર્થંકરો જેઓએ મોક્ષ પ્રાપ્ત કર્યું છે
તેની ભાવપુજા ધ્યાન કરે છે તેનેજ મોક્ષનું સાધન
લોકોત્તર માર્ગ જાળે છે જેણે સંસાર ત્યાણી સાધુ માર્ગ
સ્વીકારી યથાર્થ પાળે છે તે તેરાપંથીઓને વંફનીય નમસ્ય
છે તેવી રીતે ફૂકત શુણુપુજા તેરાપંથીઓનો સિધાંત છે.

તેરાપંથી સાધુ લોકીક અને લોકેઠર કલ્યાણમાં ખહુ અંતર સમજે છે લોકીક ઉપકાર પર ધ્યાન આપતા નથી ને લોકેઠર ઉપકારનો રસ્તો હેખાડે છે સંસારિક ઉપકાર જેડે સંસર્ગ રાખતા નથી તે સંબંધમાં ઉપહેશ આપતા નથી તેઓનો ખદ્ધો ઉપહેશ ધાર્મિક લોકેઠર હોય છે

જુંદગી સુધી નીચેના વ્રત પાળે છે પાંચ મહાબ્રત

૧ પ્રાણ્યાતિ વિરમણ વ્રત સાધુઓ સંપુર્ણ
અદ્ભુત ત્રણ કરણું ત્રણ જોગથી હોય છે સાધુપણું પચ
ઘ્યે તે વખતે પ્રતિજ્ઞા અથવા વ્રત લે તે વખતે સૌણંદ
કરે છે કે ખાદર, ત્રશ સ્થાવર કાંઈ પણ પ્રકારના પ્રા-
ણીની હિંસા મન, વચન અથવા કાયાથી કરું નહીં, કરાવું
નહીં અને કરે તેની અનુમોદના કરૂં નહીં

અને તે ઝક્કા પ્રતિજ્ઞા કરીને રહી જતા નથી પણ
પોતાના જીવનને તે પ્રમાણે વર્તનમાં મુકે છે કેશી
લીધેલા વ્રત સંપુર્ણ પગાય છે ગરમીમાં પંખાથી હુવા
દેતા નથી ડંડીમાં તાપવા એસતા નથી ભુખથી પ્રાણ
નીકળી જાય તો પણ સચિત વસ્તુ ખાતા નથી પુણ
તોડતા નથી ધાસ પર ચાલતા નંથી સચિત પાણીને અડ-
કતા નથી આ પ્રકારે પોતાનું જીવન હુર પ્રકારે સંયમી
અને અદ્ભુત જનાવવા અસાધારણ ત્યાગ કરે છે
સાચ્ચો કૈન સાધુ અદ્ભુતા ને સંપુર્ણ જાગવા હુર
પ્રકારના ત્યાગ કરે જરૂર પડે પોતાના પ્રાણું પોતાના વ્રત
પાગવા નિર્યોગન કરે છે તેને કારણુંથી સંસારમાં રહેતા

સપૂર્ણ અહિંસાના પાલન કરે છે નીચે જૈન સાધ્વાચારના નિયમ લખાય છે.

૧ હિંસાથી અચચા જૈન સાધુ પોતે લોજન પકાવતા નથી પોતાને માટે પકાવેલું લેતા નથી દેવાને લાવેલું લોજન લેતા નથી ભિક્ષામાં અચિત, પ્રાકૃક અને નિર્દેખ આહુર પાણીનો સંયોગ મળે તો લે છે અન્યથા વગર આહુર પાણી સંતોષ કરે છે કોઈ સાધુ માટે લોજનાદિ બનાવવા ઘેણેથી કહે નહી કે કાને ત્યાં ગોચરી જવાના છે.

૨ જૈન સાધુ માધુ કરી વૃત્તિથી ભિક્ષા કરે છે એટલે કોઈને એક ને ભાર સ્વરૂપ નખને માટે થોડી થોડી અનેક ઘરેથો ભીક્ષા લે છે.

૩ કોઈ લીખારી અથવા ખીંચે માગનાર કોઈના ઘર પર ભિક્ષા માંગતો હોય તો સાધુ ભિક્ષા માંગવા ત્યાં નહી જય કેમકે તેમ કરવાથી ખીંચને અંતરાય થાય.

૪. લીલોતરી, પુલ, ધાશ રાખથી ઢાંકેલી અગ્નિ પાણી વીગેરે પર થઈ સાધુ કિહુર કરે નહી

૫. જે કોઈ હુઠ સાધુને મારવા આવે તો સાધુ પ્રત્યાક્મણુ કરે નહી સમભાવ પુર્વક તેને સમજાવે ન સમજે તો સમભાથી આક્મણુ સહુન કરે અને વિચારે કે મારી આત્માનો નાશ કરી શકશે નહી.

૬. સાધુ ખાનપાન, સ્વધતા તથા મળ, વિસર્જન અથવા નિયમોથી કરે જે નિભિતે કોઈ જંતુની ઉત્પત્તિ, અથવા વિનાશ થાય નહી

૭ કોઈ કઠોર વચન સાંભળી જૈન સાધુ ચુપચાપ તેની ઉપેક્ષા કરે મનમા વિચાર કોઈ પ્રકારનો ન લાવે માર પડવાની પણ મનમાં દવેષ લાવવાની મના જૈન સાધુને છે તે તે અવસર પર પુર્ણ સહૃદાનીતા રાખવી સાધુનો આચાર છે.

એવીરીતે જૈન ધર્મમાં સર્વ નિયમોમાં અહિંસાને સ્થાન આપ્યું છે સાચા જૈન સાધુ સમ્યક પ્રકારથી તેનું પાલન કરે તેરાપંથી સાધુ આ નિયમો યથા રૂપ પાલે છે બીજાની લાંતિએ સિથિતાચારી થઈ વ્રત ભંગ કરતા નથી

(૨) ભૃષ્ણવાદ વિરમણુદ્વત્તઃ આ વ્રત અનુસાર સાધુ પ્રતિજ્ઞા કરે છે કે કોઈ પ્રકારે મન, વચન, કાયાથી જુદુ બોલીશ નહીં, બોલાવીશ નહીં, બોલતા પ્રત્યે અનુ-મેદન કરીશ નહીં આ પ્રકારે અસત્ય ભાષણુના ત્યાગ કરી સંપુર્ણ સત્ય વ્રતને અંગીકાર કરે છે સાધુને બોલતી વખતે બહુ સાવધાની અને ઉપયોગથી કામ લેવું પડે છે સત્ય હોનાથી સાધુ સાવધ પાપયુક્ત કઠોર ભાષા નહીં બોલે જે સત્ય ભાષણુથી કોઈને કદાચ ક્ષણ વિપત્તિ આવે તેવું સત્ય બોલવું પણ સાધુને મનાઈ છે માટે તેરાપંથી સાધુ કોઈ પણ પક્ષ તરફથી અથવા તેની વીરદ્ધ લવાદ અથવા પંચાયતો સરકાર દરાર કોઈ માં સાક્ષી આપી રાકતા નથી કોઈ પણ હુદાતમાં સંસારી કામમાં ભાગ લઈ શકતા નથી જે વાત સાધુ માટે હોતકારી ન હોય ત્યાં મૌન અંગીકાર કરે છે

૩. અદ્દાદાન વિરમણુ દ્વત્તઃ આ વ્રતથી

ગામમાં જંગલમાં નાની અથવા મોટી કોઈ પણ ચીજ દીધા વગર ન લેવી, ન લેવરાવવી, લેતા હોય તેને અનુમોદન ન કરવાના સોંગાંદ છે આ પ્રતથી જૈન સાધુ માતા પીતા સ્વામી સ્વી, ખીજ સંબંધીની આજાથી દીક્ષા લેવા તૈયાર હોય તેને દીક્ષા આપે છે આ પ્રત ખીજ પ્રત માર્ક મન, વચન, કાયાથી અહુણુ કરવુ પડે છે.

૪. મૈથુન વિરમણુપ્રત: આ પ્રતથી જૈન સાધુને પુર્ણ ઘ્રણાર્થ મન, વચન, કાયાથી દેવ, તીજાંચ, મનુષ્ય સંબંધી મૈથુન કરી શકે નહીં, કરાવી શકે નહીં, કરતાને લખું જાણે નહીં સ્વી માત્રને સ્પર્સ કરે નહીં પુરૂષ માત્રને સ્પર્સ સાધિયો કરે નહીં જે મકાનમાં સાધિયો કે ખીજ સ્વીયો રહેતી હોય ત્યાં રાત્રે સાધુ રહી શકે નહીં એકદી સ્વી પણ દીવસમાં રહી શકે નહીં.

૫. અપરિથક પ્રત: આ જૈન સાધુ ને ઐત્ર, વશુ એટલે બાંધેલી જમીન, ધન્ય, ધાન્ય, ઐ પગા, ચાર પાંગા હીરણુ, સુવર્ણ કુવીયધાતુ મન વચન કાયાથી રાખી શકે નહીં, રખાવી શકે નહીં, રાખતાને અનુમોદન કરી શકે નહીં ઉપરાક્ત પાંચ મહાપ્રતના પેરામાં છહું રાત્રે લોજન ત્યાગ પ્રત પણ સાધુને પાલવું પડે છે આ પ્રત અનુસાર આહુર પાણી સુર્યાસ્ત થયા પણી તે સુર્યાદ્ય થયા પહેલા મન વચન કાયાથી કરી શકતો નથી ખીજને આહુર પાણી કરાતી શકતો નથી ન કરે તેને અનુમોદન કરી શકતા નથી આ છહું પ્રત અહૃસા પ્રતતું ચાંગ છે.

(ખ) આ છે: બતો ઉપરાંત જૈન સાધુને નીચે મુજબ પાંચ સુમિતિયો પાલવી પડે છે.

૧. ઈર્યા=આ સુમિતિ રસ્તામાં ચાલતા સાધુને યોગ પુર્વક આગાળ માર્ગ જોવો પડે છે સાધુ રાતમાં મલમુત્ર ત્યાગ છોડી અથવા ભીજુ કામે અછાયામાં જઈ શકતા નથી.

દાક્યા સ્થાનમાં વિશેષ યત્ન પુર્વક જયણુા સાથ ચાલવું પડે છે ઉન્માર્ગ છોડી સીધે સરલ માર્ગ પર ચાલી શકે છે ચાલતા બહુ ઉપયોગ અને સંલાળ રાખવી પડે છે જેથી સુશ્રમથી સુશ્રમ પ્રાણીઓને ઈજા કુદ્દ પહોંચે નહીં ઉંચું આડુઅવળું જોતા રસ્તો ચાલતા વાત કરાય નહીં.

૨. ભાષા=વિચાર પુર્વક, સત્ય, સરલ, નિર્દેખ અને ઉપયોગી વચન બોલવું પોતાના વચનથી કોઈની કુદ્દ ન પહોંચે આ સમિતિનો ઉદેશ કોઈને અવિશ્વાસ ઉત્પન્ન થાયનહી ભીજા ગુર્સે થાય ભીજાનું અહૃત થાય એવી ભાષા સાધુએ બોલવી નહીં.

૩. એખણા=આહાર, પાણી, વખ, પાત્રાદિ ઉપકરણું, બાનેટાદિ વસ્તુ લેવા પુર્વે સાવધાની ઝમ લેવું તેની લીધા કરી તેનો સ્વીકાર કરવો તેના ઉપયોગથી સંયમને કોઈ પ્રકારનો આધાત ન પહોંચે તેવી રીતે ઉપયોગ કરવો. નિર્દેખ પરિચિત કિલ્ફા અલ્ય કુદ્દપ અનુસાર ઉપકરણું વીજેરે અહૃણું કરવા કોઈ વસ્તુ અહૃણું કરવા પહેલા સાધુને આ વાતની પુરી તજવીજ કરવી પડે છે કે સાધુ માટે આ વસ્તુ ખરીદી નથી લાભ્ય કે બનાવી નથી.

૪. આદાનલંડ નિકોપણુ=વસ્તુ પાત્રાદિ ઉપકરણો
ઉપયોગ પુર્વક ઉઠાવવા મુકવા કેાઈ જીવને ઈજા કુણુ
યહેંચાડવું નહી ચીજ ને સારી રીતે પુછી રાખવી ઉઠાવવી
એ સાધુનું કર્તવ્ય છે.

૫. ઉચ્ચાદિ અતિષ્ઠાપનઃ મલ, સુત્ર, સ્વેષમ
અથવા બીજા પરિહાર્ય વસ્તુ કેાઈ જીવને હુઃખ ન પહેંચે
એવા સ્થાનમાં ઉપયોગ વિસર્જન કરવા જૈન સાધુ મલ,
સુત્ર, સ્વેષમ જીવ ઉત્પન્ન કરનારી ત્યાજ વસ્તુ ત્થા ગં-
ઘણી, રોગાદિ ફેલાવવાવાળી, પરિહાર્ય ચિંનેને જહાં તહાં
કેંકી શકતા નથી અપથ્ય આહુાર, ન પહેરવા જેવા કાદા
કપડા અથવા બીજી વિસર્જન યોગ્ય ચીજે ને જીવ રહીત
એકાંત સ્થાનમાં ઉત્સર્ગ કરે છે.

(ગ) ત્રણુ ગુપ્તિ મન, વચન, કાયા

મનઃ મનના હુણ વેપારો રોકવા સારંલ, સુમારંલ,
તથા આરંલ મન, વચન, કાયાથી રોકી શુષ્ય કીયામાં
પ્રવતસુ.

વચનઃ વાણીના અશુભ વેપાર રોકવા અર્થાત
સંયમવાણીનો કરવો.

કાયાઃ એટા કામથી રોકવુ એ ઢેહનો સંયમ
સમિતિ સાધુ જીવનની પ્રવૃત્તિઓને પાપરહીત
અનાવે છે. અર્થાત અવશ્યક કીયાઓ કરાવે છે. સાધુ
સમિતિ પાલન કરણુ આપના લાગી થતા નથી ગુપ્તિ
અશુભ વેપારથી નિવૃત કરવામાં સહાયતા કરે છે આવી

ચીતે જૈન સાધુ જીવન સંપૂર્ણ સંયમી થાય છે એ એટલા અધ્યવહાર કુશળ હોય છે કે સંયમી જીવનની બધી કુશળ કરતા સાવધાની ઉપયોગથી કરે કે પાપ કર્મ લાગે નહિ.

જૈન શ્વેતાંખર તેરાપંથી સાધુ એ નિયમ ભરાખર પાળે છે સખત નિયમાદિ વખત વખત પર આચાર્યો એ બનાવ્યા છે તે પર પૂર્ણ ધ્યાન રાખી પોતાનો સંજમ નીલાવે છે.

જૈન શ્વેતાંખર તેરાપંથી કોઈ નવો મત સંપ્રદાય નથી પણ તે આદિ મુળ જૈન ધર્મ છે જૈન ધર્મ ને આદિ સ્વરૂપ હતો તે હજરો વર્ષોના પડોશી ધર્મોના સંસર્ગ અથવા પ્રલાવથી એટલો બદ્ધલાઈ ગયો હતો લેળસેળ થયો હતો કે તેનું અસલ સ્વરૂપ લોકોને હેખાંડાય છે ત્યારે જુદ્દો નવો ધર્મ સમજ વિરોધ કરે છે પણ તે કંઈ આશ્રૂર્યની વાત નથી જૈન ધર્મમાં સમય અને વાતાવરણુના પ્રલાવથી ને વિકાર થયો એ ધીરે ધીરે લોક એટલા અભ્યાશી થઈ ગયા કે જૈન ધર્મની અસરી અને વિકૃત ઝપમાં લેદ કરવો મુશ્કેલ થઈ ગયો જ્યારે ધર્મ પોતાના ઉંચ સ્થાનથી પડવો શરૂ થયો ને પડોસીધર્મે નેર પકડયું તો કંઈક જૈન લેખક અથવા વ્યાખ્યા કરેનો એ જૈન સુત્રોના પાઠોના અર્થ બદ્ધલવા શરૂ કીધા અને તેના એવા અર્થ હુનીયા સામે રાખ્યા ને જૈન ધર્મથી વિપરીત છે તેના નવા સુત્ર રચ્યા નવા સુત્ર પત્થર પર કેતરાવવામાં આવ્યા બીજા ધર્મોના સિધ્યાંતોથી મલતા હુતા આ પ્રકારે જેકડો વર્ષોથી ફેરફાર થાય એટલો

વિકાર આવ્યો કૈન ધર્મ અસલ સ્વરૂપ અને પછી ઘણોઃ
અંતર પડી ગયો અનેક મહાત્માઓએ ધર્મધુરંધરોને
કૈન ધર્મતું સત્ય સ્વરૂપ શોધવામાં પોતાના હુથ લગા-
વ્યા અને છેવટે સકૃદાતા પણ મળી સંત ભીખણુણ
પણ તે મહાયુરુષામાંના એક છે બધાની પછી થયા પણ
અધિક મહેનત લીધી ને સકૃદાતા મળી શ્વામી ભીખણુણને
મત નવો ધર્મ નથી પણ કૈન શાસ્ત્રોક્ત ધર્મ સનાતન
સ્વરૂપમાં જે લોકો જાણુતા ન હતા અને તે કૈન ધર્મમાં
અન્ય સંપ્રદાય છે જેના મુળ પ્રાચીન છે તેની સાથે આશ
વાતો મતલેદ પડેછે થોડામાં આ મતલેદો બતાવે છે.

૧. શ્રી તીર્થંકર લગવાન ઝેકૃત નિરવધ
કરણુણીની આજ્ઞા આપે છે સાવધ કરણુણીની આજ્ઞા
આપે નહીં નિરવધ કરણુણીથી જીવ મોક્ષ પામે છે પણ
સાવધ કરણુણીથી નવા કર્મ બંધાય છે જીવની હુર્ગતિ
થાય છે જે કર્મ રોકવા, કાપવાના કાર્ય છે તે કરવા
લગવાન આજ્ઞા આપે છે પણ બીજા સાવધ પાપાખ્રવ લોકીક
કામ તેમાં પ્રભુ જુનેશ્વર આજ્ઞા આપતા નથી તેરાપંથી સંપ્ર-
દાય તે જ માને છે નિરવધ કામ અથવા લગવાનના અનુ-
મોક્ષિત કામ કોઈ પણ મતાવલમ્બી કરે તેને આજ્ઞા છે
કૈનના બીજા સંપ્રદાયવાળા કૈનેતરની શુદ્ધ કરણુણી આજ્ઞા
બહુર માને છે.

એ કરણુણી સંસારમાં, સાવધ નિરવધ જાણ ॥
નિરવધમાં જાણ આજ્ઞા, તેથી પામે પહ નિર્વાણ ॥

નિરવધ

નિરવધ

સાવધ કરણી સંસારની, તેમાં જુન આજા નહી હોય ।
કર્મ બંધે છે તેહુથી, કર્મ ન જાણો કોય ॥
કર્મ રોકાય તે કરણીમાં આજા,
કર્મ કરે તે કરણીમાં જાણુરે ।
આ એ કરણી વિના નવી આજા,
ને સધણી સાવધ પીછાણુરે ॥
જે જે કારજ જુન આજા સહીત છે,
તે ઉપયોગ સહીત કરે કોયરે ॥
તે કારજ કરતાં ધાર હોવે જીવની,
તેનો સાધુને પાપ ન હોયરે ।
નહી માંહે તણુાતી સાધીને,
સાધુ રાખે હુથ સંલાવે ॥
તે માંહી પણ છે જુનજુની આજા,
તેમાં કોણુ પાપ ભતાવે રે ॥
ઈયા સમિતિ ચાલતાં સાધુથી,
કદાચ જીવ તણી હોય ધાત ।
તે જીવ મુવાનો પાપ સાધુને,
લાગી નહી અંશમાતરે ॥
જે ઈયા સમિતિ વીના સાધુ ચાલે,
કદા જીવ મરે નહી કોય ।
તો પણ સાધુ ને હિંસા છકાયની લાગે,
કર્મ તણો બંધ હોય રે ॥

જીવ સુવા ત્યાં પાપ ન લાગ્યો, ન સુવા ત્યાં લાગો પાપ।
જીવ આજા સંલાળો જીણુ આજા જીવો, જીન આજામાં
પાપ ન થાપોરે ॥

૨. તેરાપથી સંપ્રદાય જ્યા તીર્થંકર ભગવાની આજા ત્યાં ધર્મ અને જ્યાં વીતરાગ હેવની આજા નહી ત્યાં અધર્મ માને છે.

જેમ આહાર સરખા ધર્મી સાધુઓને વહેચી આપવો ને ખાવું આજામાં છે તે સાધુ માટે ધર્મ છે પરંતુ કોઈ સાધુ કોઈ હુષ્ટના આકમણુ કરે તે વખતે તે સાધુની પક્ષ લઈ કોઈ પણ સાધુ માટે અત્યાચારી ને દંડ આપે, મારે વીરોરે બળપ્રકાશ કરે તે આજા ખહાર છે મના છે છે સાધુ એક શ્રાવકની વ્યાવચ કરે, કરાવે ને અનુમોદે તે પાપ છે કારણુ કે પ્રભુ આજા ખહાર છે.

(3) ગ્રલુએ જ્યાં મૌન રાખી ત્યાં પાપ ધર્મ પાપ મદૈ નહી જ્યાં ગ્રલુએ હુ અને ના બંન્નેમાં પાપ સમજ ત્યાંજ મૌન ધારણ કરી છે દાખલા સ્વરૂપ કુવા ઐદાવવામાં કોઈ માણુસ ભગવાને પુછે ગ્રલુ કુવો ઐદાવવામાં મને પાપ થશો કે પુણ્ય ગ્રલુએ આ પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહી પણ મૌન ધારણ કર્યું અહીંયા કુવા ઐદાવવામાં જીવ હિંસા પુણ્ય કહે તો જુઠ લાગે ને પાપ કહે તો કુવો ઐદાવતો બંધ થઈ જાય તો અંતરાય લાગે પાણી લોકો ન મળે તેથી અંતરાય કર્મ લાગે અને મોહનીય કર્મનો બંધ બિનો અંતરાયનો બંધ

માટે ભગવાન પ્રશ્નનો ઉત્તર ન આપે કૈનના કેટલીક સંપ્રદાયવાલા મૌનનો સમ્મતિના લક્ષણું કહે છે પરંતુ વિચાર કરવાથી એવી માન્યતા બ્રાન્ત માલમ પડશે નીતિ વિદોને “મૌન સમતિ લક્ષણુમાં” જરૂર બતલાયું છે પરંતુ નિતી અને ધર્મમાં બહુ અંતર છે નિતીની માન્યતા અનુસાર હુમે મૌન ભાવ સદ્ગ સર્વદાને માટે સમ્મતિકા લક્ષણું પ્રમાણું નહીં કરી શકતા અને કૈન ધર્મ અનુસાર તો “મૌન”નો અર્થ સમતિ કેાઈ અંશમાં નથી.

૪. વ્રતમાં ધર્મ અવ્રતમાં અધર્મ છે કૈન ધર્મ એ લેદ કરે છે એક આળુંવૃત્તિયા ગૃહુસ્થ જીવનમાં રહી આત્મ કલ્યાણું સાધન પ્રયાસ કરે ખીજ મહુાવતી ને સર્વ વ્રતી સાધુ હોય છે આ બંને પ્રકારના સાધકોના આદર્શ ભરતમાં હોય છે પરંતુ અહિંસા, સત્ય, અર્યોર્ય, અધ્યાત્મ, અપરિશ્રહ આત્મ કલ્યાણું સાધનો બંને સમાન રૂપમાં કરી શકતા નથી શ્રાવક અહુસ્થાશ્રમી છે પોતાના અહુ આવશ્યકતાએને કારણું આ વ્રતોમાં અંશીક રૂપમાં જ સ્વીકાર કરે છે અથવા મર્યાદિત ધર્મનું પાલન કરે છે પરંતુ સાધુ સંપૂર્ણ રૂપથી આ વ્રતોમાં અંગીકાર કરે છે ગૃહુસ્થ છુટ આગાર રાખે છે સાધુ કોઈપણું પ્રકારે છુટ આગાર રાખતા નથી શ્રાવક આગાર ધર્મની સાધુ અણુગાર ધર્મી છે શ્રાવક જેટલા પ્રમાણુમાં વ્રત પાળે છે તેટલા અંશમાં ધર્મપક્ષનું સેવન થાય છે જેટલી છુટ રાખે તેટલો અધર્મ આગાર રાખતા થાય છે સાધુ સંપૂર્ણ અંશમાં આ વ્રતો સેવે છે તે ઇકત ધર્મપક્ષના સેવનાર છે કૈન શ્વેતાંધર તેરાપંથ મત અનુસાર શ્રાવક જેટલો આગાર રાખે તેટલા પાપ થાય છે દ્વાપદો

શ્રાવક સોગાંહ કરે કે મીલ આડ કલાક ચલાવીશ આડ કલાક
 મીલ ચલાવવામાં પાપ જરૂર છે બાકી સોણ કલાક તે મીલ
 ચલાવી શકતો હતો પણ ત્યાગ કરે છે તે ધર્મ છે જે
 કોઈ દારૂદીયો સાધુ સમાગમના કારણુથી દારૂનુ હુઃખદાયક
 પરિણામ સમજી ત્યાગ ભાવથી પોતાની ટેબથી સંપુર્ણ
 દારૂ પીવા છોડવા અસમર્થ હોય તે એખ્યાલાથી વધારે
 દારૂ પીવાના ત્યાગ કરે તો એખ્યાલાની દારૂનો દોષ
 લાગે વધારે પીવાના પચખાણુ કર્યા તે ધર્મ છે
 આગાર કમનેરીનું કારણ છે તે પાપ છે ત્યાગનો
 ખરાખર અર્થ સમજ્યા વગર આગારને પણ ધર્મ માને છે
 આવી રીતે શ્રાવકનું ખાવું, પીવું, ચાલવું, ઝરવું વીજેરે બધી
 અપ્રતની વાતોમાં કર્મ બંધાય છે. પરંતુ સાધુ અણુગારી
 હોવાથી તેને કોઈ પ્રકારનુ પાપ લાગતુ નથી જે સાધુ
 માઝુક સર્વભર્તી નથી ને શ્રાવક માઝુક આણુભર્તી નથી તે
 અસંયતી છે તેને પાપના રસ્તા ચારે બાળુથી ખુલ્લા
 છે જે જેટલા અંશમાં બ્રત અંગીકાર કરે છે તેટલા
 અંશમાં પાપકર્મથી બચે છે તેને નવા કર્મનો સંચાર
 તેટલા અંશમાં થતો નથી જેટલી વધારે છુટ આગાર
 રાખે છે તે પોતાની ઈચ્છાના કમ સંયમ છે તે તેટલા
 અધિક પાપોપાર્જન કરે છે કેટલાક જૈન નામધારી
 કહે છે કે શ્રાવકની છુટો માટે તેનાથી ધર્મ થાય છે
 ગૃહસ્થિક જીવનના નિર્વાહ માટે એ છુટોની જરૂર છે
 પણ તેરાપણી અમાં પાપ કહે છે લગવાને સાધુઓને
 જે છુટ આપી છે તે તેઓનુ સંયમી જીવનનુ અંગ છે

માટે ધર્મ છે શ્રાવકની છુટ તેની પોતાની અનાવેલી છુટ છે તે ગૃહસ્�િક જીવનનું અંગ છે માટે અસંયમની વૃદ્ધિ પોષણ છે એટલે પાપ છે કેટલીક છુટ ધર્મના ચથેચિત્ત પાલન માટે જરૂરી છે બીજાની છુટ ગૃહસ્થીને વીશેષ લિપ્ત થવાને છે માટે અનેમાં ધર્ણ અંતર છે સાધુની છુટ ધર્મપોષક છે તેમાં સંયમ રક્ષાનો ગંભીર હેતુ રહ્યો છે શ્રાવકની છુટ સંયમ ધર્મની ખાધક છે આત્મધાતક છે જે જે કીયાઓ સંયમી જીવનની ખાધક છે તેનો લગવાનનો પુર્ણ નીચેધ કર્યો છે શ્રાવકની છુટો પાપમાં છે બીજી સંપ્રદાયથી તેરાપંથીઓનો મત આ વિષયમાં જુદો પડે છે માટે ન્યાયથી સત્યા સત્યનો નીર્ણય કરવો.

જીવ જીવ તે દયા નહીં,
મરે તેણો હિંસા નહીં જાણુ ।
મારણુવાલાને હિંસા કહી,
નહીં મારે તે દયા ગુણુ ખાનણો ॥

અનંતા જીવ ફુનીયામાં જીવતા રહે છે તેથી દયા અનુકૂળા નથી જીવ પોતાના આયુષ્યથી અથવા સ્વો પાર્શ્વત કર્મથી જીવ છે ન્યારે આયુષ્ય પુરુ થશો ત્યારે કેાઈની તાકાત નથી કે જીવતો રાખે માટે જીવ જીવ છે તેમાં કેાઈનો અહેશાન નહીં એવી જ રીતે અનંતા જીવ આયુષ્ય પુરુ થયે સ્વોપાર્શ્વત કર્મથી મરે છે તેની હિંસા નહીં જીવવું મરવું આ સંસારમાં ચાલી રહ્યું

છે કોઈ માણુશ કોઈ જીવની ધાત કરે ત્યારે તે ધાત કરવાના નિમિત્ત અથવા સહાયકના કારણથી તેને પાપ લાગે છે કોઈ જીવને સર્વથા પ્રકારે ન મારવાના ત્યાગ કરવા તે મોટી દ્વયા છે અહિંસા ને લગવાને પુરી દ્વયા કહી છે જે માણુશ અહિંસાનું પ્રત અંગીકાર કરે છે અને તેનું પુર્ણ પાલન કરે છે તેથી તે સંસારના સર્વ જીવોનો અભય દાતા છે જીવોને તેનાથી કોઈ પ્રકારનો ભય નહી મન, વચનને કાયામાં અહિંસાનું પાલન કરવુ, ખીજ કોઈ જીવની હિંસા ન કરવી, ખીજ પાશે કરવવી નહી, કરે તેને અનુમોદન ન કરવું એજ દ્વયા છે અભયદાન એ સઉમાં મોટી દ્વયા છે એથી બધારે દ્વયાની કલ્પના થઈ શકતી નથી સર્વ જીવ સુખ ચાહે છે છે હુઃખ બધાને અપ્રિય છે મૃત્યુનો બધાને ભય છે માટે જ્યારે કોઈ ન મારવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે બધા જીવોનો ભય દૂર થઈ જય છે પોતા તરફથી કોઈને ભય રહેતો નથી એથી બધારે કોઈ દ્વયા નથી.

જૈન મત મુજબ બધી કાયના જીવ સરખા છે જૈન મત મુજબ એકેન્દ્રિય સુધી કોઈ જીવમાં ફરક નથી એકના સુખના માટે ખીજને હુઃખ પહોંચાડવું તે જૈન દ્વિજિતમાં પાપજનક છે સુખ બધા જીવ ચાહે છે માટે પંચેન્દ્રિયના સુખને માટે એકેન્દ્રિયની ધાત કરવી, રાગદવેષ કરવો સારો નહી, માટે સાધુ સચિત વસ્તુઓને હાન આપવા ઉપદેશ કરતા નથી કરવતા નથી. અને કરે તેનું અનુમોદન કરતા નથી જ્યા એક જીવ

ખીજ જીવને અપટ રહ્યો છે ત્યાં સાધુ નિર્વિકાર ચિત્તથી
 તટસ્થ રહે છે તે એકને ડરાવી ખીજને બચાવવા કોશીશ
 કરતા નથી ખીલાડી ઉંદર પર અપટ મારી રહી છે ત્યારે
 સાધુ ખીલાડીને ડરાવી નશાડવાની કોશીશ કરે નહિ અને
 ઉંદર ભરે તે પણ ચહુાય નહિ એવા અવશરે સાધુ
 નિર્વિકાર ચિત્તથી ધ્યાનસ્થ એસે ન્યાયની દૃષ્ટિથી એમ
 કરવું ઉચ્ચિત છે એક જીવને જખરજસ્તીથી ભુખો રાખી
 ખીજ જીવને બચાવવો ન્યાયની દૃષ્ટિથી બરાબર
 નથી એ તો એકને અપટ લગાવી ખીજનો
 ઉપદ્રવ હુર કીધો રાગ દ્રેષના કાર્યોથી સાધુ હુર
 રહે છે જ્યાં એ જીવમાં આપશમાં લડાઈ થાય ત્યાં
 સાધુ ધર્મનો ઉપદેશ દઈ કાર્ય કરે છે ધર્મનો
 ઉપદેશ આપે છે જખરજસ્તી કરતા નથી જ્યાં ઉપદેશ
 નહી દેવાય અથવા ઉપદેશની અસર લાગે નહી એમ
 લાગે ત્યાં સાધુ રાગદ્રેષરહિત મૌનધારણ કરે અથવા ત્યાંથી
 ઉઠી ખીજ જગ્યા ચાલી જાય કૈન ધર્મ કોઈના હુર્ગુણ
 જખરજસ્તીથી છોડવવા ચહુાતો નથી સ્વામી શ્રી
 લીલાખુલુએ કહ્યું છે કે—

મુલા, ગાજર ને કાચુ પાણી લોગીના કોઈ લોગજ દુંઘે
 કોઈ જખરીથી કે ખોસીરે વળી પાડે અંતરાયો રે
 ને કોઈ વસ્તુ છોડાવે વગર મન મહામેહુની કર્મજ બાંધે
 એ રીતે ધર્મ ન હોસી રે દશાશ્રુતખંધ મે ખતવ્યો રે
 લીલોતરી ખાવામાં અને સચિત પાણી પીવામાં
 એકેન્દ્રિય જીવની હત્યા થાય છે પાપ છે પરંતુ કોઈ

દીકોતરી કંદમુળ ખાતા ને પાણી સચિત પીતા જખર-
જસ્તીથી છીનવી લેતો જૈન ધર્મની દૃષ્ટિએ ધર્મ નહીં
એમજ અહિંસાનો સિદ્ધાંત છે અહિંસા માને કે નહીં
પણ હિંસા પ્રેમિયોની હિંસા વગર મન બળજખરીથી
છોડાવે તો એવી બળજખરી, બળપ્રયોગથી હૃદયનુ
પરિવર્તન નહીં વગર મન કોઈ કામ કરવામાં ધર્મ
નહીં એમ તો સંસાર હિંસામય છે જગહજગહ હિંસા
થઈ રહી છે તેને રોકવા સંભવ નથી.

માણુસ પોતે મન વચન કાયાથી અહિંસક છે તો તેની
સામે હિંસા થાય તેનું પાપ તેને નહીં હિંસા કરવાવાલાને
કરવાવાલાને અનુમોદન કરવાવાલાને હિંસાનું પાપ લાગે
છે જેવા વાલાને પાપ લાગતું નથી જેવા વાલાને પાપ લાગે
તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને
અનંત બળવાળા અરિહુંત ભગવાન ત્રીકાલહર્ષી કેવલ
જાનીને પાપ લાગવું જોઈયે સાધુ હિંસાના કામો જોઈ
ચલચિત થતા નથી પરંતુ વીવેક પુર્વક તટસ્થા ધારણુ
કરે છે બળનો પ્રયોગ કરી જીવ ધાત રોકવામાં પાપ છે
જૈન શાસ્ત્રોમાં કોઈ લોગીના લોગ જખરજસ્તીથી રોકે તે
મહુા મોહુની કર્મ બંધાય એ ન્યાયથી સાધુ જીવમાત્રને
પોતાનામાં લડાઈ, માર, પીટ વીજેરેમાં વચમાં પડે નહીં
ઉપરેશ દ્વારા સમજાવે, નહીં તો તેનાથી નિવૃત રહે ન્યાયની
દૃષ્ટિથી એજ ઉચ્ચિત છે. પક્ષપાત રાગદવેષ બધા કર્મનું
સુળ છે કેટલાક લોક આ વાતનું રહુસ્ય સમજ્યા સીવાય
અનિન ધર્મિઓના હેખાદેખ હ્યાના સ્વરૂપ ખીન અતલાવે છે.

આ પ્રકારે ખળ અથવા જખરજસ્તીથી કામ લેવાથી જ્યાં રક્ષકને કોઈ લાલ થતો નથી ઉદ્દો અંતરાય પાપ કર્મ લાગે છે ત્યાં આત્માનો કંઈ સુધારો થતો નથી વગર મન ધર્મ પાતન કરાવવાથી ધર્મ થતો નથી

(૬) સુપાત્ર દાનથી ધર્મ થાય છે કુપાત્ર દાનમાં સંસાર કીર્તિ થાય પુણ્ય નહીં થાય જૈન શાસ્ત્રોમાં ઉપર બતાવ્યા પ્રમાણે દશદાન વર્ણવ્યા છે પરંતુ બધામાં ધર્મ સમજવો નહીં શકું ઉપયહુદિની શાંતિ માટે ધર્યા ધાન્ય અપાય છે તે પણ દાન છે લંજ વિવાહ અવસરે મોસાળું, પહેરામણી, વીરેરે થાય છે તે પણ દાન છે પણ તેમાં ધર્મ નહિં, આપવાથી ફૂકત ધર્મ સમજવો નહીં દાનથી ધર્મનો લાલ કરવો હોય તો વિવેકથી આપવું જોઈયે સુપાત્રને દાન આપવું કુપાત્રને દાન આપવા એ ધર્મને બહલે પાપો પાર્જન કરવું છે જે જીવ સર્વથા હુંસા કરતા નથી સર્વથા જુઠ બોલતા નથી સર્વથા ચોારી કરતા નથી સંપુર્ણ શીયલ પાળે છે અને કોઈ પણ કારણથી પરિચ્છક રાખતા નથી પાંચ મહુન્નત પાળે છે, પળાવે છે પાળે તેની અનુ-મોદના કરે છે ત્રણુ કરણુને ત્રણુ જોગથી તેજ સુપાત્ર છે એવા સુપાત્રને દાન આપવું તેજ સુશેત્રમાં બી રોપવા માફક ફળ આપનાર છે જેનામાં ગુણુ નહીં તે કઢાપી સુપાત્ર નહીં તેને દાન આપવામાં ધર્મનું કારણ થઈ શકતું નથી સંસારિક કર્તાવ્ય હેઠય પણ સંસારીકથી ધાર્મીક વાસ્પદ્યાભ જુહો છે..

દાન આપવામાં દયાનો ઉલંઘન ન થાય તે પુરો ખ્યાલ રાખવો કે દાનથી દયાતું ઉલંઘન થાય તે સાચું દાન નથી સ્વ. દાર્શનિક કવી શ્રીમહ રાયચંદ્રલુએ કહ્યું છે કે:—

સત્ય શીલને, સધળાં દાન, દયા હોઈને રહ્યા પ્રમાણુ ।
દયા નહી તો એ નહી એક, વગર સુર્ય કીરણ નહી હેઠ ॥

અંત દયા નીરક્ષા કરતા દાન હેતું જોઈયે જે દાનમાં જીવોની હિંસા રહી હોય તે સંસારીક લોકીક દાન છે માટે સળવ ધાન્યાદિકું દાન સાધુ સ્વયં લે નહી લેવ-રાવે નહી એવા દાનની પ્રશાંસા અથવા અનુમોદના કરે નહી ભગવાને સાવધ દાનના જગ્યા જગ્યા કડવા કૃષિ ખતાવ્યા છે ને આત્મધાતક ખતલાવ્યા છે.

જે દાનથી આત્મિક કલ્યાણ અથવા ધર્મ પુણ્ય થવાનું ખતલાવ્યું છે તે દાન જુદ્દા છે સાચા જૈન ધર્મના રહુસ્થોને ખતલાવી કોઈને સન્માર્ગ પર લાવવા તે સમ્યકીતી સાચા દર્શન માનવાવાળા ત્થા સત્યરિતી ખનાવવું એજ ધર્મ દાન છે સાચા જૈન સાધુ મુનિરાજને તેઓના તપસ્વી જીવન લાયક શુદ્ધ કદ્દપતી વસ્તુઓના દાન આપવા તે શુપાત્ર દાન છે તેનાથી નવા કર્મ આવતા રોકાય છે કર્માની નિર્જરા થાય છે ધર્મ પુણ્યનો સ્વચાર થાય છે એવા દાન સંપુર્ણ નિર્વિદ્ય હોય તો ભગવાન ચોતે એવા દાનની આજ્ઞા આપે છે કેમાં અસંયતિ જીવોનું પોખણું થતું હોય અથવા જેમાં અસંયતિ જીવોની

ધાત થતી હોય અથવા ખીળ પાપ વહ્તા હોય તેવા દ્વાન ધાર્મિક દૃષ્ટિથી સર્વદા અકારણીય છે સંસારિક દૃષ્ટિથી કોઈ કરે તેમાં કોઈ ના કહેતું નથી.

તેરાપંથી સાધુઓની તપસ્યા

તેરાપંથી સાધુ બહુ ઉચ્ચ તપસ્યા કરે છે શ્રી મુખાજી મહાસતીજી એ નીરંતર ૨૬૭ દીવસના ઉપવાસ કર્યા હતા આવી લાંખી તપસ્યા ઉકાળેલી છાશના ઉપરનું લીલું પાણી લીલું હતું. કોઈ સાધુએ પાકા પાણીથી ૧૦૮ની તપસ્યા કરી છે એક સાધીએ ૨૨ ચોવીહાર ઉપવાસ કર્યા હતા.

તેરાપંથી સાધુના આચાર નિષ્ઠા તેઓનો સંપન્ન નિયમાનુવત્તિતા તથા તપસ્યામય જીવન જે જેય છે તે સર્વ અનુમોદન કરે છે.

તેરાપંથી સંપ્રદાયના સાધુ સાધિ ધાર્ણી મહુત્વપૂર્ણ તપસ્યાએ કરે છે થોડા તપસ્યાના વર્ણન નીચે મુજબ છે. રાત્રે જૈન સાધુ સાધિ કોઈ પણ ચીજ ખાતા નથો ઉપવાસનું પારણું સુર્યોદય પછી કરે છે ઉપવાશના દીવસોમાં પાકું પાણી, અથવા છાશ ઉપરનું ઉકળેલું પાણી લે છે બીજું કંઈ નહીં.

પહેલા એ આચારોના શાશનમાં છ મહીના લગી નીરંતર તપસ્યા થઈ ન હતી ત્રીજ આચાર્ય મહારાજશ્રી રાયચંદ્રલુના શાશનમાં પહેલા પહેલા છ મહીનાના નિરંતર ઉપવાસ સ્વામી શ્રી પૃથ્વીરાજજી મહુરાજે કીધા તેઓ મારવાડ લુલ્યાના પાત્રેદીય શામના હતા તેઓની

દીક્ષા શાં. ૧૮૬૬માં મહારાજશ્રી હેમરાજજીને હુથ
પુનય મહારાજ ધીરાજના હુકમથી થઈ હતી તેઓનો
વીવાહ થયો હતો સ્વી ત્યાગી દીક્ષા લીધી દીક્ષા લીધા
પછી છ વર્ષોમાં વચ્ચમાં વચ્ચમાં ઉપવાશ કરતા હતા પણ
૧૮૭૭થી ફરેક ચોમાસામાં મોટી મોટી તપસ્યો કરવી
શરૂ કરી તે નીચે મુજબ.

સંવત	ગામ	ઉપવાશ
૧૮૭૩	સિરિયારી	૪૦ દીવસ
૧૮૭૪	ગોગુંડા	૮૨ ,,
૧૮૭૫	પાલી	૮૩ ,,
૧૮૭૬	દેવગઢ	૧૦૬ ,,
૧૮૭૭	પુર	૧૨૦ ,,
૧૮૭૮	આમેટ	૯૬ ,,
૧૮૭૯	પુર	૧૦૦ ,,
૧૮૮૦	પાલી	૬૦ ,,
૧૮૮૧	પાલી	૭૫.૨૧ ,,
૧૮૮૨	પાલી	૧૦૧ ,,
૧૮૮૩	કંકરેલી	૧૮૬ ,,

છેલ્લા ૧૮૬ દાડા ઉપવાસ શાં. ૧૮૮૭ના જેઠ વદમાં
શરૂ કર્યા હતા પહેલા દાડાના ઉપવાશમાં આચાર્ય શ્રી રાય-
ચંદ્રજી મહારાજની સામે છમાશ નીરંતર ઉપવાશ કરી લીધા
એ સાધુએ ખીજાએ પણ ઉપવાશ છમાશના પચુણ્ણા તેના
નામ શ્રી ષર્ધમાનજી મહારાજ શ્રીજા શ્રી હીરાલાલજી મહારાજ

આ લાંખી તપસ્યાં પછી એક મહીનો રણી સ્વામી શ્રી પૃથ્વીરાજાલુ સ્વર્ગરેષુદ્ધ થઈ ગયા.

સ્વામી પૃથ્વીરાજાલુના સમકાલીન શ્રી શિવલુના સ્વામી મહારાજ જોટા તપસ્યી હતા તે બાદના વંશના ઓશવાલ જન્મ મેવાડમાં લવ ગામ તેની તપસ્યા નીચે મુજબ.

ઉપવાશ	સંખ્યા	ઉપવાશ	સંખ્યા
		૧૪	૩
		૧૫	૩
૧	૪૧૪	૧૬	૨
		૩૦	૧૨
૨	૨૨	૩૨	૧
૩	૩૪	૩૪	૨
		૪૦	૧
૪	૮	૪૫	૬
૫	૧૧	૫૦	૨
૬	૭	૫૫	૧
૭	૩	૬૦	૫
૮	૬	૭૫	૨
૯	૩	૮૦	૧
૧૦	૩	૧૮૬	૧
૧૧	૩		
૧૨	૩		
૧૩	૨		

આ તપસ્યી શાળાને દેહસાન ચં. ૩૬૧૧ શૈક્ષ

સુદ્ર આશરે સો વર્ષ પહેલા થયો હાલ તપસ્વીમાં શ્રી ચુનીલાલજ મહારાજ શ્રી રઘુજીત મહાજ મહારાજ શ્રી આશારામજ મહારાજ સુખ્ય હુતા.

સ્વામી શ્રી ચુનીલાલજ મહારાજ સરદાર શહેરે બીકાનેર જીવા નાયટા વંશના ઓશવાલ હુતા શાં. ૧૯૪૦ માં દીક્ષા થઈ શાં. ૧૯૪૪થી એકાંતર ઉપવાસ કરવા માંડ્યા છ વર્ષ સુધી એક દીવસ પછી એક દીવસ અપવાશ કર્યા શાં. ૧૯૫૦માં છુટુ તપસ્યા ચાલુ કરી એ દીવશ પછી પારણું કરતા વળી એ દીવસ ઉપવાશ એમ એક મહીનામાં દશ દીવસ આહુર કરતા બાકી વીશ દીવસ નીરંતર ઉપવાશ કરતા આવી તપસ્યા ૨૩ વર્ષ શાં. ૧૯૭૨ સુધી કીધી પછી અહુમ અહુમ પારણું કરવા શરૂ કર્યા ત્રણું દાહાડા ઉપવાશ પછી એક દીવસ આહુર કરતા એ તપસ્યા સાડાત્રણ વર્ષ કરી એ તપસ્યા સીવાય તેઓએ નીચે સુજખ તપસ્યા કરી હતી.

ઉપવાશ	સંખ્યા	ઉપવાશ	સંખ્યા
૧	૫૦૦	૧૦	૧
૨	૩૬	૧૧	૨
૩	૩૬	૧૨	૧
૪	૪૪	૧૩	૧
૫	૨૫	૧૪	૨
૬	૩	૧૫	૧
૭	૨	૧૬	૧
૮	૧	૧૭	૧
૧૧	૧	૧૮	૧

સ્વામી ચુનીવાલાલ આ તપસ્યા ઉપરંત “લઘુસિંહ” તપસ્યા કરી હતી તે લઘુસિંહ તપની ચાર શ્રેષ્ઠી હોય છે દરેક શ્રેષ્ઠીમાં ૧૮૭ દીવસમાં ૧૫૪ દીવસ ઉપવાશ ને ૩૩ દીવસ પારણું હોય છે પહેલી શ્રેષ્ઠીમાં પારણુમાં વીગય હે છે બીજી શ્રેષ્ઠીમાં વીગય નહી હે ત્રીજી શ્રેષ્ઠીમાં પારણુમાં લેપપ્રયોગ કરે નહી.

લઘુસિંહ તપ ધણ્ણું કઠણું છે ઉપવાશ આરંભ કરી દીવસ નીરંતર ઉપવાશ કરવા પડે છે.

ઉપવાશ છુટું અટું પછી એક દીવસ પારણું કરે છે નિરંતર નવ દીવસ તપસ્યા કર્યા બાદ કુમવાર પાછા ઉત્તરવું પડે છે પાંચ અપવાશ કરતા છેવટ એક ઉપવાશ આવે છે.

આ તપસ્યા ચાર વખત કરી તેઓ ઉચ્ચ તપસ્વી હુતા ત્રણું શ્રેષ્ઠીયોનું વર્ણન ઉપર કર્યું ચોથી શ્રેષ્ઠીમાં પારણુમાં ઇક્તા અડદના બાકલા લેવા પડે છે સ્વામી ચુનીવાલાલ ત્રણું શ્રેષ્ઠીની તપસ્યા પુરી કરી ચોથી શ્રેષ્ઠી પુરી કરવા પહેલા દેહાંત થયો તેરાપંથીના એક સાધુ શ્રી હુલાશ મહારાજ ચોથી, પહેલીને ત્રીજી શ્રેષ્ઠી તક તપસ્યા પુરી કરી બીજી શ્રેષ્ઠી શરૂ ન કરી શક્યા પાંત્રરીશ વર્ષ સાધુ જીવનમાં સાધુ ચુનીવાલાલ આડ હજર હતું ઉપવાશ લગભગ ખાવીશ વર્ષ તપસ્યા કરી.

હું સ્વામી શ્રી સ્વાલ્પતમ્બાલ ત્યા શ્રી ગાંધી

રામજીની તપસ્યાનું વર્ણન.

સ્વામી રણજીત મલજીનો જન્મ શા. ૧૯૧૮ મેવા-
ડમાં પુર ગામમાં ચોથમલજી બનોલીયાના છોકરા હતા.
ચોથમલજીએ આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી
મેધરાજજી સ્વામીને હૃથ દીક્ષા લીધી હતી શ્રી ચોથ
મલજી પોતે ઉથ તપસ્વી હતા તેઓએ સં. ૧૯૫૪માં
ઇ મહીનાથી તપસ્યા કરી હતી શા. ૧૯૫૬માં સ્વર્ગ
રેઠાણું થયા સાથું શ્રી રણજીત મલજી બહુ તપસ્વી થયા
શા. ૧૯૭૪થી કોઈ વખત લાગલાગત એ દાઢાડ આહાર
કરોં નથી તેઓ ધણું વીનયવાન તપસ્વી હતા તેઓના
અંતીમ ઉપવાસ નિરંતર ૬૦ દિવસના હતા શા. ૧૯૮૬
વરએ અષાઢ સુદ ૨ ને દાઢાડે પુજ્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮
શ્રી શ્રી કાલુ ગણીરાજ સરહાર શેહેર પદ્ધાર્યા તે વખતે
શ્રી રણજીત મલજીએ પારણું કીધું હતું તે દાઢાડે
આચાર્ય મહારાજ પાસે સંથારો કરવા આજા માંગી પરંતુ
પુજ્ય મહારાજે આજા સંથારાની ન આપી નિરાશ થઈ
સ્વામી શ્રી રણજીત મલજી તપસ્યા કરતા હતા જ્યારે
અવસર જેતા ત્યારે સંથારાની આજા માંગતા લાદરવા સુદ
૨ ને દીવસે સાહ દીવસમાં એકવીશ દાઢાડ પાણી ન લીધું
લાદરવા સુદ ૨ સથારે આશરે ૭૦ ધારે સંથારાની એજા.
આપી હોટ કલાક પઢી સ્વર્ગે સીધાબ્યા.

તેચોણી તપસ્યા

ઉપવાશ	સંખ્યા	ઉપવાશ	સંખ્યા	ગામ
૧	૨૬૭૫	૨૧	૧	
૨	૩૭	૩૦	૧	
૩	૮	૩૧	૧૭	
૪	૧૧	૪૫	૧	
૫	૧૦	૪૭	૧	
૭	૨	૫૨	૧	
૮	૧	૬૦	૨	
૧૦	૧	૧૦૧	૧	ગોગુંઢા
૧૧	૧	૧૮૨	૧	રાજનગર
૧૫	૧			

સાધુ શ્રી આશારામજી જન્મ મારવાડ રાજ્ય વાલો-
તરાના ઓશવાલ પીતા સુશ્રભવતજી લંડારી હૃતા પરણેલા
હૃતા ખળવાન આત્મા છોવાથી સંસારિક બંધન તોડી શાં
૧૬૭૦ વરખે શ્રાવણ સુદ ૭ ને દહુડે દીક્ષા લીધી.

તપસ્યાનું વાર્ણુન

ઉપવાશ	સંખ્યા	ઉપવાશ	સંખ્યા
૧	૧૩૬૭	૧૧	૨
૨	૬૩૦	૧૨	૩
૩	૧૧૧	૧૩	૧
૪	૧૪	૧૫	૧
૫	૨૫	૨૫	૧

ઉપવાશ	સંખ્યા	ઉપવાશ	સંખ્યા
૬	૨	૩૦	૧
૭	૨	૩૧	૨
૮	૩	૩૫	૧
૯	૧	૪૧	૧
૧૦	૧		

એ ઉપરાંત ૭ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યાં
પાંચ વર્ષ છઠું કર્યાં તો-તોર દીવસની તપસ્યા પુર્ણ કર્યાં
પછી શાં ૧૯૬૦ ચૈત્ર વદ ૭ ને દીવસે ચાડવાસમાં સ્વર્ગ-
રોહણ થયું તપસ્યામાં પદ દીવસમાં પાણી સીવાય બધી
ચીજ ત્યાણી હુતી છેવટે સાત દીવસ ગરમ પાણીના પણ
ત્યાગ કર્યાં ગૃહુસ્થાશ્રમમાં ત્રીશ દીવસ ત્થા પરચુરણ તપ-
સ્યા કરી હુતી.

આ તપસ્યાની ભતલખ ફૂકતા આત્મિક કલ્યાણ છે.
સામાજિક રાજ નૈતિક કારણોથી કંઈક ઉપવાસ કરે છે પણ
જૈનતર જનતાએ જાણુવું જોઈએ કે જૈનો ઉચ્ચા આશાયથી
ઉપવાસ કરે છે આત્મકલ્યાણ અને કર્મથી છુટવાને માટે
ઉપવાશ કરે છે જીવાત્માનો કર્મ સાથ સંલેળ રહ્યો હાય
છે તેથી આત્માને તેના અસલી રૂપમાં લાવવા કર્મ સંચોગ
હુર કરવા તપસ્યા કરે છે જૈનો સાંસારિક, સામાજિક અથવા
રાજ નૈતિક ઉદેશ સર્જણ કરવા ઉપવાશ કરતા નથી જૈન
સાંસ્ક્ર મુજબ આત્માને આત્મિક કલ્યાણ વધારવા કર્મ હુર
કરવા સિવાય કેાઈ લાલ પહોંચાડતા નથી એવી તપસ્યામાં
જે કષ્ટ ઉઠાવવો પડે છે તે વ્યર્થ નહીં જતાં તેને
લાલ મળે છે.

એવી તપસ્યા ફરકત સાધુઓજ કરતા નથી પણ
શ્રાવક અને શ્રાવીકાઓ પણ કરે છે ચોમાસામાં જ્યા
સાધુ સાધ્વિઓ ચોમાસા કરે છે ત્યાં શ્રાવક શ્રાવીકા ધણું
ઉમંગ અને મોટા આનંદથી મોટી દુઃસાધ્ય તપસ્યા કરે છે.

તેરાપંથી સાધુઓની નિયમાનુવર્ત્તિતા તેરાપંથી
સંપ્રદાયમાં નિયમ અને સંગઠન ઉપર પુરુ ધ્યાન અપાય
છે સમસ્ત સાધુ સાધ્વિઓને નિર્દીષ્ટ નિયમોનું પાલન
કરવું પડે છે સિથિલાચાર થઈ શકતો નથી સાધુનો
ઉદેશ આત્મકલ્યાણ છે તે સંયમયાત્રા નિર્વાહ માટે શાકો-
કત રીતિથી ચાલે છે તેરાપંથી સાધુ સાધ્વિ સમાજને તેના
ગુણોથી વંદ્નીય પુજનીય છે કદાચ તેઓના ગુણોમાં ફરક
ન પડે માટે સાધુ અને શ્રાવક બારીક નજર રાપે છે
જેના પગામાં શ્રાવક માણું નમાવે છે તે સાધુનો આદર્શ,
ચરિત્ર, આચાર તેવા ઉચ્ચપદ લાયક રહે તેવી ભાવના
હુંમેશા રહે છે.

૧. સાધુ સાધ્વિ કોઈપણ ગુહુસ્થની સહૃદય લેતા નથી
તેઓ પગે ચાલે છે કોઈ વાહુન રાખતા નથી જોજ કોઈ પાસે
ઉપડાવતા નથી પોતે પેસા આપી અથવા ખીજ પાસે
અપાવી રેલ્વે મોટર વગેરે વાહુનને ઉપયોગ કરવાના પરિચિહ્ન
ત્યાગ ક્રત અને અહિંસા ક્રતનો ભાગ સમજે છે ઈર્યાં
સમિતિનો બાધક બાધે છે એવા નાના પ્રકારના હોષ
વાહુનનો ઉપયોગ કરવામાં બાધે છે શ્રી તીર્થકરદેવની
આજા નથી.

૨. તેરાપંથી સાધુ સાધિ કોઈ ગૃહસ્થ પણે પત્ર વહેવાર, પોસ્ટ, તાર, ફુત, આદમી મ્યારક્ષત કરાવતા નથી પોસ્ટ, તાર, બહુન, વહાણ અથવા ખીજા સાધનો મારક્ષત પોસ્ટ વીજેરે મોકલવો એ હિંસાજનક જાણે છે.

૩. તેરાપંથી સાધુ સાધિ, રાજ્ય, કોર્ટ, લવાદી, પંચાયતી કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતીએ સાક્ષી આપતા નથી.

૪. તેરાપંથી સાધુ કોઈ ગામમાં સાધારણ રીતે એક માશથી વધારે રહેતા નથી ચોમાસામાં ચાર મહિના એક જગ્યા રહે છે જ્યાં એક માશ રહે ત્યાં એ મહીના ક્રી આવી શકતા નથી જ્યાં ચોમાસુ કરે ત્યાં એ ચોમાસા રહી શકે નહીં. પણ ગામાનું ગામ વીચરતા એવા ક્ષેત્રમાં એક રાત રહેવાની જૈન શાસ્ત્રોની આજા છે અને તેજ મુજબ તેરાપંથી સાધુ કરે છે.

૫. તેરાપંથી સાધુ સાધિ પુસ્તકાદિ ઉપકરણ જગ્યાં જાય ત્યાં પોતે સાથે લઈ જાય છે ગૃહસ્થીને સેંપી જતા નથી જૈન સાખાનુસાર દરેક જૈન સાધુ પોતાના ઉપકરણ વખ, પાત્ર, કંખલ, પુસ્તકાહિની દરરોજ પડીલેહણું કરવી જોઈયે કોઈપણ ઉપકરણમાં કોઈપણ જીવની વીરાધના થવી ન જોઈયે જો સાધુ સાધિ કોઈ લાંડાર અથવા ગોડાઉનમાં પુસ્તકાદિ મુક્કી જાય તો દરરોજ પડીલેહણું થઈ શકે નહીં એ સિથિલતા શાશ્વત ભર્યાદાનું ઉલંઘન કરનાર છે.

૬. સાધુ સાધિને પરિચ્છુ રામવાની કૈન શાસ્ત્રોમાં મનાઈ છે. કાચ પત્થર પરિચ્છુ છે તેરાપંથી સાધુ સાધિ

કોઈ પણ ચરંમા (Spectacles) રાખતા નથી કોઈ પણ ધાતુ રાખતા નથી કપડા માટે પણ નિયમ છે સફેદ કપડા ચથા પરિમાણ રાખે છે પોતાને માટે કોઈ પણ ખાવાની, પીવાની, વસ્તુ, વસ્તુ, પુસ્તક, કાગળ તૈયાર કરાવતા નથી વેચાતા લેવરાવતા નથી અથવા સાધુને ઠેકાણે લાવી આપે રે પણ પદ્ધાર્થ લેતા નથી.

૭. તેરાપંથી સાધુ સાધ્વિ માથાના વાળ, દાઢોમુછ અસ્તારાથી ઉત્તરાવતા નથી વરસમાં એ વખત પોતાના વાળનો લોચ કરવો પડે છે લોચનો પરિસહૂ ખડુ કઠણુ છે.

૮. તેરાપંથી સાધુ કોઈપણ તરાહુના જોડા, મોળા, સ્વીપર, પાવડી વીજેરે કંઈ રાખતા નથી સખત ગરમીમાં જીની રેતીમાં પહુાડી જમીનમાં લયાનક ઠંડીમાં જમીન ઉપર ખુલ્લા પગે વીચરે છે.

૯. તેરાપંથી સખાવતી હોસ્પિટાલની દવા લેતા નથી કોઈ શ્રધાલું વૈદ, ડેંકટર પોતાની દવાઈઓમાંથી કોઈ દવા પોતાની દંચાથી દાન કરે તો લે છે જરૂર હોય તે ડાક્ટર પાસે હુથીઆર માંગી લાવી સાધુ પોતે ઓપરેશન વહાડકાપ કરે છે હોસ્પિટલમાં જઈ ઓપરેશન કરાવે નહીં.

૧૦. તેરાપંથી સાધુ વીજળીના પંખા, હુથ પંખા, વીજળીની ખતી, ઝાનઘાની ખતી કોઈ ખીલ ગ્રકાણી રોશની, ચાંદળું, હવા લઈ શકે નહીં ઠંડીના વખતમાં ચાગડી ધરમાં શુભતા નથી નહીં, કુલ્લા, તળાબ, વીજેરેના ચચ્છિત સલ્લાવ પણી કે નહીં હિંસાવળું કોઈ કાળું કર્શું,

કરાવવું, કરે તેને અનુમોદવાની ત્રણુ કારણુને ત્રણુ જેગથી જૈન સાખોની મનાઈ છે.

૧૧. કોઈપણ સામાજિક, રાજ નૈતિક, આર્થિક સાંસારિક અથવા કાનુની કોઈપણ વેપારમાં સાધુ સાધિવ લાગ વે નહીં નૈતિક એટલે આત્મજિતતિના કામમાં પોતાનો વખત ગંભેરે છે. કોઈ માણુસ સાધુઓને કોઈ પ્રકારે કૃષ્ણ પહોંચાડે તો સાધુ તેની વીરુદ્ધ પોતાની રક્ષા માટે રાજ્ય દરખાર, થાણા, કચેરી પોલીશમાં ખખર આપી શકે નહીં કોઈપણ કેશમાં શાક્ષી આપી શકે નહીં અથવા બીજથી કોઈ તરેહુનો સહુયોગ કરી શકે નહીં.

૧૨. તેરાપંથી સાધુ સાધિવને કોઈ મઠ, મંદીરસ્થાન, અપાશરા સ્થાનક નથી ગૃહસ્થોના ઘરમાં રજથી ઉત્તરે છે.

૧૩. તેરાપંથી સાધુ સાધિવ ખધા ઉચ કુળના મહુજન સંપ્રદાયમાંથી દીક્ષા લીધેલી છે જીવન પર્યંત શ્રી આચાર્ય મહુરાજની આજાનુસાર ચાલવું પડે છે ફરેક સાધુને મોટા સાધુની આજા માનવી પડે છે નાનામોટા દીક્ષા પ્રયાય પ્રમાણે છે.

૧૪. માતાપિતા ગુરુજન પતી પતિનિ એવા નજીકના સગાયોની લખીત આજા સીવાય કોઈને તેરાપંથી સંપ્રદાયમાં દીક્ષા અપાતી નથી તીવ્ર વૈરાય, સંયમ નિર્વાહ સામર્થ્ય વીગેરે યોગ્યતા જોઈ દીક્ષા લેવાની દ્રદ મન ધણી અરજ કરવાથી આચાર્ય મહુરાજ યોગ્ય દીક્ષારીને લોકેની સામે દીક્ષા આપે છે. જૈન ધર્મના સુખ્ય સિદ્ધાંતોથી

પરચિત વૈરાગ્ય ભાવનાવાવા. નવ વર્ષની ઉમરવાવાને દીક્ષાઃ
અપાય છે.

૧૫. ઉપરના નિયમ આચાર્યોની ખનાવેલી મર્યાદાઃ
બધા સાધુ સાધિવાને પાલવું પડે છે કેાઠ નિયમ લંગ
કરે તેને આચાર્ય મહુરાજ દંડ પ્રાયશ્ક્રિત આપે છે દંડ.
પ્રાયશ્ક્રિત સ્વીકાર ન કરે તેને સાથે રાખતા નથી આ
નિયમ મુજબ પપત સાધુ સાધિવ પંનખથી દક્ષિણ સુધી
કંચ્છ ગુજરાત મધ્યપ્રાંત અને જુદા જુદા દેશોમાં એક
આજામાં એક શાશનમાં એક દીતીએ એક આચાર્યની
આજા મુજબ વીચરે છે.

તેરાપથી સાધુ સાધિવાએ.

તેરાપથી સંપદાયમાં હુલ શા. ૧૬૬૭ના વૈશાખ માશ
સુધી ૧૫૧ સાધુ: ૪૦૨ સાધિવ કુલ પપત આશરે છે બધા
સાધુ સાધિવ એક આચાર્યની આજામાં છે જુદા જુદા ૮૧
શેહુરોમાં તેઓના ચોમાશા થયા છે આ બધાને દરરોજના
કામનો લખીત હીસાબ રોજનીશી આચાર્ય મહુરાજને
આપવો પડે છે; પોતે ધર્મ ધ્યાનમાં વીચરે છે જીવેને આત્મ
ઉન્નતિ ઉદ્ધારનો ધર્મોપદેશ આપવાનું તેઓનું કામ છે.

માહ મહોત્સવ

એ આચાર્યોની લાંબી નજરનું કુળ છે દરેક વર્ષ
બધા સાધુ સાધિવાના કાર્યક્રિલાપ, આચાર વ્યવહાર,
ચોચ્યતા વીજેરે જેવા માટે ચોમાસુ ઉત્તર્યા પણી માહ
મહીને આચાર્ય ક્યાં ખીરાજતા હોય ત્યાં બધા સાધુ

સાધિ આવી પુનર્ય મહારાજના. દર્શન કરે છે એટલે સાધુ સાધિની કોનફરન્સ ભરાય છે આચાર્ય મહારાજને પોતા પોતાના ધર્મ પ્રચારકાર્યનો પરિચય બાપે છે મહા સુદ ૭ ઉપર શરીર અશક્તાના કારણું સિવાય અથવા હુર પ્રદેશમાં વીચરવા આચાર્ય મહારાજની આજા હોવાથી સામેલ થવા અશક્ત હોય તે સિવાય બધા સાધુસાધિ દર્શન કરે છે તે દીવસે અથવા તે લગભગ ભાવી ચોમાસા માટે કયા કયા સાધુ સત્યિઓને કયા કયા ગામ ધર્મ પ્રચારાર્થે મોકલવા તે શ્રાવકોની અરજ ત્થા ખીજુ ઘણી ખાખ્યતોનો વીચાર કરી આચાર્ય મહારાજ ઝરમાવે છે આ અવશરે ઘણું ગામના શ્રાવક શ્રાવકોની કોનફરન્સ ઘણું વર્ષોથી ભરાય છે એકજ જગ્યાએ ઘણું સાધુ સાધિઓના દર્શન માંહોમાંહે મેલાપ ઘણી વાતો પર વીચાર થાય છે. જ્યાં આજ લાઈ લાઈમાં લડાઈ પીતા પુત્રમાં દ્રેષ્ટ સ્વજન જાતિમાં ટેટો ત્યાં જુદા જુદા દેશોના પરીવારના લોકો સાધુ સાધિના એક આચાર્યની આજામાં એક ભગવાન ભાષીત ધર્મની છત્રછાયામાં, મુક્તીની એક-માત્ર લક્ષ ખનાવી જ્ઞાન દર્શન, ચારિત્રના આધાર પર દાનશીલ, તપ ને ભાવનાના ખળથી આત્મોનંતિ કરે છે. સાથે સાથે ભવ્ય જીવોને સહૃપદેશ દઈ આચાર્ય મહારાજ તારે છે આ અવશર જરૂર જેવા જેવો છે પવિત્ર મૂર્તિ મહાત્માઓના દર્શનથી પાપ હુર થાય મહાપુરુષોની વાણી સાંભળી ભવ્ય જીવ કૃતાર્થ થાય ભરતક્ષેત્રમાં સંસારી જીવને તેરાપંથો સાધુ સાધિ દેશને, સમાજને રાષ્ટ્રને ગૌરવરૂપ છે.

તेરાપથી સાધુ સાધિઓની.

આજકાલ વિદ્ઘાનોના સમાદર વીધા સર્વત્ર છે. શાસ્કોના અધ્યન, અધ્યાપન, વ્યાખ્યાન વીગેરે માટે વિદ્ઘાની ખણુ જરૂર છે શ્રીશ્રીશ્રી ૧૦૮ શ્રીશ્રી તુલશી ગણ્ણી રાજના. સમયમાં તેરાપથી સંપ્રદાયમાં સારા સારા વીદ્ઘાન પંડિત મુનીરાને છે નાની ઉમરમા પોતે સંસ્કૃત પાકૃત વીગેરેનો ખણુ અભ્યાસ કર્યો છે ભક્તામર અને કલ્યાણ મંદીર જેવા સ્તોત્રોની પાદપુરીરૂપ કાલુ ભક્તામર સ્તોત્ર અથવા કાલુ કલ્યાણ મંદીર વીગેરે કાવ્યો જેવા જેવા છે શ્રી પુન્નયાજ મહારાજધીરાજ સકલ ગુણુનીધાન ખાલ પ્રહ્લાદારીની દેખ-રેખ નીચે સાધુઓએ સંસ્કૃત વ્યાકરણુની રચના કરી છે. તે અપુર્વ અથ છે વૈજ્ઞાનિક શૈલીથી ખધા વ્યાકરણુનો સાર લઈ વ્યાકરણસુત્ર ખનાવવું પુરુ પંડિતાઈનું કામ છે.

હુમે ખધા જૈન અથવા જૈનેતર વીદ્ઘાનોને દર્શનીક અથવા ધાર્મિક તત્વોના જ્ઞાસુ ને ખાશ કરી જૈન શાસ સાહીત્યના અનુસંધાન પ્રેમી સન્નજનોને વીનંતી કે જૈન જ્વેતાંખર તેરાપથી સંપ્રદાયના આચાર્ય મહારાજ અને તેના સાધુ સાધિ જેના બને તેના દર્શન કરેા જોઓના. સંયમ, ત્યાગ, વૈરાગ્ય તપસ્યા તપ્ષસ્સો જુઠી જીંદાને ભરોયો કરેા નહીં.

લોકીક અને લોકોત્તર કાર્ય સમજો.

જેન ધર્મ સમજવા નીચેના વીશ પ્રક્રિયા સમજવા
જરૂરી છે.

- ૧ શ્રીમદ આચાર્યજી કરે
- ૨ શ્રીમદ ઉપાધ્યાયજી કરે
- ૩ શ્રીમદ સાહુજી કરે
- ૪ શ્રીમદ આચાર્યજી ન કરે
- ૫ શ્રીમદ ઉપાધ્યાયજી ન કરે
- ૬ શ્રીમદ સાહુજી ન કરે.
- ૭ શ્રાવક સામાયકમાં કરે
- ૮ શ્રાવક પોષામાં કરે
- ૯ શ્રાવક ઉપધાનમાં કરે
- ૧૦ શ્રાવક સામાયકમાં ન કરે
- ૧૧ શ્રાવક પોષામાં ન કરે
- ૧૨ શ્રાવક ઉપધાનમાં ન કરે
- ૧૩ લોકીક કાર્ય છે .
- ૧૪ લોકોત્તર કાર્ય છે
- ૧૫ કરે તે કોણુ
- ૧૬ ન કરે તે કોણુ
- ૧૭ ધર્મ છે
- ૧૮ ધર્મ નથી
- ૧૯ પ્રતમાં છે
- ૨૦ અપ્રતમાં છે

૧૮

પાંચસો મણુ સચીત ચણુ, અડદ, બુવાર, મગ તૈયાર
 છે એક ખોણો કૈન સાધુ નાંઝે તોઃપાંચસો મણુ ગૌશાલા,
 પાંજરાપોળમાં નાખવા તૈયાર છે દયા, દાન બાંને માલમ
 પડશે વખત દહાડો, જર્બ્યા નક્કી કરી લખવા મહેરખાની
 કરશોણ.



અપવાસ દ્વારા આરોગ્ય

અપવાસ કરીને જુદા જુદા
દોગો મટાડનારાઓની કહાણીએ
સાથે, ડેવી રીતે અપવાસ
કરવા તેને લગતી તમામ
હકીકતોથી છલાછલ ભર-
પૂર અનુ ઉપરોગી થાંથ

કિંમત ઝપિયા અઢી
ટ પા લ અ ચં જુ હં.

એક નકલ ધરમાં પડી હશે તો ખચરવાળ
કુદુંખમાં સેંકડો ઝપિયા ખચાવી આપશો.

૧૦ પીંઠી અંગાવવા લખો:—

ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત.



ભાગ્નવાન્તિક

જરૂર વાંચો.

247
550